


# વ्यसनमुक्त



ડૉ. કેતના ઝવેરી

ભણશાળી ટ્રસ્ટ સંચાલિત  
જુવન શૈલી કિલાનિક, સુરત.


## અનુક્રમણિકા

<b>તન-મન-ધનને પાચમાલ કરતાં વ્યસનો</b>	
<b>૧. તમાકુ</b>	<b>૩</b>
તમાકુથી ઉદ્ભવતા રોગોની યાદી	૬
બીમારી અને મોત નોતરતી તમાકુની વિવિધ વાનગીઓ ( ? )	૮
પેસિવ સ્મોકિંગ - એકની મજા બીજાને સજા	૯
બાળકો અને તરણોને તમાકુથી બચાવો	૧૧
તમાકુ કંપની છારા આયોજિત રમતગમતની સ્પર્ધાઓ	૧૩
ખતરનાક ગુટખા અને પાનમસાલાઓ	૧૫
તમાકુ છોડવાના ફાયદાઓ	૧૮
તમાકુ કષ રીતે છોડશો?	૧૯
તમાકુ છોડવા માટે દવાઓ, નિકોટીન પેચ અને રચ્યુંગાગમ	૨૧
તમાકુ છોડવાનાં સરળ પગથિયા	૨૨
<b>૨. દારૂ</b>	<b>૨૪</b>
દારૂની શારીર ઉપર થતી અસરો	૨૪
દારૂનો જીવલેણ ડોઝ અને દારૂ પીવાથી થતાં મૃત્યુનાં જોખમો	૨૯
દારૂથી થતી લિવરના સિરોસિસ અને જલોદરની તકલીફ	૩૦
અડધો અડધી વાહન અકસ્માતો માટે દારૂ જવાબદાર હોય છે	૩૪
દારૂ પીવાથી સ્વાસ્થ્ય સુધરે કે બગડે?	૩૬
દારૂની ઉપલબ્ધતા ઘટતાં દારૂ-સંબંધિત પ્રજ્ઞનો પણ ઘટે છે.	૩૮
દારૂની બોગસ પરમીએ બંધ કરો	૪૦
શું તમે આલ્કોહોલિક ( દારૂડિયા ) છો?	૪૧
દારૂડિયા બનવાની પ્રક્રિયાના તબક્કાઓ	૪૨
દારૂ બંધ કરવો હોય તો શું કરશું?	૪૩
એક વખત દારૂ છોડવા પછી ફરીથી વ્યસન શરૂ થવાની પ્રક્રિયા	૪૯
<b>૩. કેફીન ( ચા - કોફી - કોલા - કોકો - ચોકલેટ )</b>	<b>૫૦</b>
<b>૪. અફીણ - હેરોઇન - બ્રાઉન સુગર</b>	<b>૫૩</b>
<b>૫. ચરસ - ગાંઝો - ભાંગ</b>	<b>૫૫</b>
<b>૬. કોકેઇન</b>	<b>૫૬</b>
<b>૭. એલ.એસ.ડી.</b>	<b>૫૭</b>
<b>વ્યસનો છોડવા માટેની બિહેવીયર થેરપી</b>	<b>૫૮</b>

## તન-મન-ધાનને પાયમાલ કરતાં વ્યાસનો


### ૧. તમાકુ

આખા વિશ્વમાં દર વર્ષ આશરે ગીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે; અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ગીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વાર્ષિક મૃત્યુનો આંક સિસેર લાખને આંબી જશે! જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અક્સમાત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઈને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અક્સમાતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અક્સમાતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઈ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઈ આવા ફોટો સાથે શ્રદ્ધાંજલિ આપે છે!




તમાકુ એક એવું ઝેર છે જેને કોઈ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને હુંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદ્ભવે છે.

રોજની એક પેકેટ સિગરેટ પીનાર માણસ આખા વર્ષમાં આશરે ૭૦,૦૦૦ કશ મારે છે અને એટલે ૭૦,૦૦૦ વખત એ વ્યક્તિનાં મોનાક, ગળું અને ફેફસાં સિગરેટમાંથી નીકળતા કાતિલ જેરના સંપર્કમાં આવે છે. વર્ષો સુધી આવું કાતિલ જેર ઘોઝ્યા પછી કેન્સર જેવા રોગો ન થાય તો જ નવાઈ ! દરેક બીડી-સિગરેટ માણસની આવરદામાં પાંચેક મિનિટનો ઘટાડો કરતી જાય છે ! બીજા શબ્દોમાં કહીએ તો, એક વ્યક્તિ બીડી-સિગરેટ હુંકવા પાછળ જેટલો સમય બગાડે છે, લગભગ એટલો જ બીજો સમય એની જિંદગીમાંથી આ બીડી-સિગરેટ હુંકી મારે છે! તમાકુથી થતા રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે અને આપતાં વીસેક વર્ષમાં એનાથી થતી તકલીફોનું પ્રમાણ ઝડા અને એઈડ્સ જેવી બીમારી કરતાં પણ વધી જશે જે સાથેના ગ્રાફમાં દર્શાવ્યું છે.



તમાકુનો વપરાશ કરનારાઓમાંથી અહોઅદ્ધ લોકોના મોતનું કારણ તમાકુ જ હોય છે. જો વિશ્વમાં એક પણ માણસને બીડી-સિગરેટ હુંકવાની કુટેવ ન હોત તો વિશ્વમાં કેન્સરનું પ્રમાણ આજે છે એના કરતાં અડ્યું થઈ જાત. થોડાં વર્ષો પહેલાં ભારતમાં આશરે ગ્રીસ હજાર વ્યક્તિઓનો દશ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવેલો આ અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે મો-જીબ અને ગળાના કેન્સરના જેટલા દર્દી હતા એમાંથી સમ ખાવા પૂરતોથ એક પણ દર્દી એવો ન હતો જેને કોઈને કોઈ પ્રકારે તમાકુનું વ્યસન ન હોય!

આપણા મનમાં કેન્સરનો જેટલો ‘હાઉ’ છે એનાથી દસમાં ભાગનો ‘હાઉ’ પણ તમાકુ માટે નથી! ખરેખર જરૂર છે તમાકુથી બચવાની - તમાકુનો વપરાશ બંધ થતાં કેન્સર તો આપોઆપ બંધ થઈ જશે. કેન્સર જેવા જીવલેશ રોગની હજ દવા પણ નથી શોધાઈ અને આ જ કેન્સરને ખાત્રીપૂર્વક ઉગતો જ અટકાવી શકાતો હોય ત્યારે માત્ર ઘડી બે ઘડીની મોજ માટે એને નોતરું આપવા જેટલી મૂર્ખાંભી બીજ કઈ હોઈ શકે?




તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઈ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હદયની જે બીમારી અન્ય લોડોમાં મોટી ઉમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ઊંઘ થાય શક્યતા હોય. આમ, બરયુવાનીમાં હદયરોગથી મૃત્યુ થવાના ડિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં હદયરોગનું પ્રમાણ ઓછું હોય છે. હવે સ્ત્રીઓમાં પણ તમાકુનું વ્યસન વધવા લાગ્યું છે, અને સાથોસાથ જ સ્ત્રીઓમાં પણ હદયરોગ અને ફેફસાંના કેન્સરનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જો સ્ત્રી ગર્ભનિરોધક ગોળીઓ અને સિગરેટ બંને વાપરતી હોય તો હદયરોગ થવાની શક્યતા ભયજનક રીતે વધી જાય છે. (અન્ય સ્ત્રીઓ કરતાં હાર્ટએટેકની શક્યતા ઊંઘ વધુ) આ ઉપરાંત સિગરેટથી ગર્ભદ્વારના કેન્સરનું પ્રમાણ વધે છે તેમજ સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

કેન્સર અને હદયરોગ જેવી ગંભીર જીવલેશ બીમારીઓ ઉપરાંત સિગરેટને કારણે બ્રોન્કાઇટીસ, એમ્ફ્લાઇસીમા (શ્વસનકોષોના નુકસાનથી ફેફસાંનું વધુ પડતું

કુલવું), એસિડિટિ, પેનિટિક અલ્બર (જઠર - પકવાશયમાં ચાંદાં પડવાં), પેરાલિસિસ નો હુમલો વગેરે અનેક પીડા-દાયક રોગોને નિમંત્રણ મળે છે. કાયમી ખાંસી અને શ્વસનતંત્રમાં વારંવાર થતું ઇન્ફેક્શન (ચેપ) એ બીડી-સિગરેટના વ્યસનીઓ માટે કાયમી ઘટના બની જાય છે. અને આ બધા રોગો પાછળ થતો ખર્ચ, સિગરેટ પાછળ થતા કુલ ખર્ચ કરતાં અનેક ગણો વધી જાય છે.



બીડી-સિગરેટના બે કશ મારવા કે તમાકુવાળા પાનની બે પિચકારી મારવાની કિમત કેટલી ભારે હોય છે એનો અછડતો અંદાજ પણ આ વ્યસનીઓને નથી હોતો. તમાકુ ધરાવતી વસ્તુઓ (બીડી, સિગરેટ, ગુટખા, પાનમસાલા વગેરે) ખરીદવા પાછળ થતો ખર્ચ તો આખા સમાજને થતા કુલ ખર્ચનો એક નાનો ભાગ માત્ર છે. આ ઉપરંત, વ્યસનીની માંદગી પાછળ થતો તબીબીખર્ચ, માંદગીને કારણે પડતી રજાઓ અને તકલીફીથી વેડફાતા માનવ-કલાકો, આઇસિક આગને કારણે થતું નુકસાન અને વ્યસનમુક્તિ-કેન્દ્રો પાછળ થતા ખર્ચાઓ સમાજ માટે મોટા ભારૂરૂપ બની જાય છે.

જે ઘરમાં વડીલો બીડી-સિગરેટ ફૂંકતા હોય તે ઘરમાં ઉછરી રહેલાં બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધુ માંદાં રહે છે અને આ બાળકોની માંદગી પાછળ 30% વધુ ખર્ચ થાય છે. જો સગર્ભા સ્ત્રીને તમાકુનું વ્યસન હોય તો કાચો ગર્ભ પડી જવાની, ગર્ભાશયમાં જ શિશુનું મૃત્યુ થવાની તે જન્મયા બાદ તુરંત મૃત્યુ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વળી, જો બાળક જીવિત જન્મે તો પણ એ બાળકના વજન, ઊચાઈ અને પરિપક્વતા અન્ય બાળક કરતાં ઓછાં જ રહે છે. બાળકના લાંબા ગાવાના શારીરિક અને માનસિક વિકાસમાં પણ સગર્ભાવસ્થા દરમ્યાન અને તે પછી પણ સિગરેટ પીતા રહેવાથી વિક્ષેપ પડી શકે છે. સિગરેટ પીતા રહેવાનો તમારો શોખ કે ફૂટેવ તમારા બાળકને બીજા બાળકોથી નીચું દેખાડવામાં કારણભૂત બની શકે છે. ટૂંકમાં, બીડી-સિગરેટ-તમાકુ શરીરને, કુટુંબને અને સમાજને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ દૂષણને ઊગતું જ ડામવું જોઈએ. દેખાદેખી, શોખ, ફેશન કે ટેન્શનથી દોરવાઈને કાતિલ રોગો કરનાર તમાકુરૂપી ઝેરને કદી હોઠે લગાવવાની ભૂલ ન કરશો.

## તમાકુથી ઉદ્ભવતા રોગોની યાદી

કેન્સર : ફેફસાંનું કેન્સર, શાસનળીનું કેન્સર, અન્નાનળીનું કેન્સર, મો-ગળાનું કેન્સર, જીલનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર.


શસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.

હૃદયના રોગો : એન્જિના પેક્ટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.

પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેટીક અલ્સર, મો માં ચાંદાં પડવાં, દાંતને તુકસાન.

ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.

પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.



## બીમારી અને મોત નોતરતી તમાકુની વિવિધ વાનગીઓ ( ? )

### કૂંકવાની તમાકુ-

- સિગરેટ
- બીજી
- સિગાર (ચિરુટ, સ્ટૂભેન, ચુંડા, ધુમતી)  
(તમાકુ આથવીને વપરાય)
- પાઈપ (હુકલી, સુલ્ફા, સિલમ)
- (પાણીમાં પસાર થઈને ધુમાડો આવે)
- હુકલા (ગોળા, નારધીલ)

(નોંધ: ચુંડા અને ધુમતી સળગતો ભાગ મૌંમાં રાખીને કૂંકવાની આદત ગ્રામીણ ભારતની ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે.)

### ચાવવાની તમાકુ

- તમાકુના તાજા પાન ચાવવા
- નાગરવેલના પાનમાં સુકી તમાકુ નાંખીને ખાવી (કઢીપુરી,  
ગુન્ડી, કડ્પમ, ઝરદા, પતીવાલા, કિમામ.)
- પાન મસાલા, ગુટખા
- માવા
- જૈની


### સુંદરવાની કે દરસાવાની તમાકુ

- છીકણી
- શ્રીમીસ્નન્દ (ઇંડ્ઝો)

જે ઘરમાં વડીલો બીડી-સિગરેટ કૂંકતા હોય તે ઘરમાં ઉછરી રહેલાં  
બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધુ માંદાં રહે છે.

સિગરેટ પીતા રહેવાનો તમારો શોખ કે કુટેચ તમારા બાળકને બીજ  
બાળકોથી નીચું દેખાડવામાં કારણભૂત બની શકે છે.

## પેસિવ સ્મોકિંગ - એકની મજા બીજાને સજા



જેણે બીડી-સિગરેટ ન પીવી હોય એવા માણસને ફરજિયાત બીજાની બીડી-સિગરેટના ધુમાડા શાસમાં લેવા પડે એ સ્થિતિને પેસિવ સ્મોકિંગ કહેવાય છે. આવા પેસિવ સ્મોકિંગનો અનુભવ લગભગ દરેક જણને બસ, ટ્રેન, થીયેટર, હોટલ, ઓફિસ વગેરે જરૂયાઓએ થયો જ હશે. આ રીતે બીજાની સિગરેટના ધુમાડા શાસમાં જવાથી આરોગ્યને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. બીડી-સિગરેટ ફૂંકવાનો આનંદ કોઈ લે અને એનું પરિણામ બીજાએ ભોગવવું પડે એવો ઘાટ થાય.

સિગરેટના ધુમાડામાં બે જાતના પ્રવાહ હોય છે એક મુખ્ય પ્રવાહ- જે સિગરેટ ફૂંકનાર વ્યક્તિએ કશ ખેંચીને પછી બહાર કાઢ્યો હોય છે અને બીજો સાઈડ પરનો ફાંટાવાળો પ્રવાહ - જે સિગરેટના બજાતા ભાગ પરથી સીધો જ વાતાવરણમાં ભણે છે. તમાકુ બજવાથી ઉત્પન્ન થતાં હાનિકારક પદાર્થો આ બંને પ્રવાહમાં હોય છે. પરંતુ સાઈડ પરના પ્રવાહમાં એનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તમાકુમાંથી નીકળતું એરી રસાયણ નિકોટીનનો ૭૫ ટકા ભાગ આ સાઈડ પરના પ્રવાહમાં જ હોય છે. એટલે કે સિગરેટ પીનાર વ્યક્તિ પોતાના શાસમાં તો માત્ર ૨૫ ટકા નિકોટીન જ લે છે અને બાકીનું ૭૫ ટકા નિકોટીન ધુમાડા વાટે અન્યોના શાસમાં જાય છે.

બાજુ પરના (ફંટાવાળા) પ્રવાહમાં મુખ્ય પ્રવાહ કરતાં નીચેના પદાર્થોનું વધુ પ્રમાણ જોવા મળે છે- નિકોટીન (૨.૭ ગાણું વધારે); કાર્બન મોનોક્સાઈડ (૨.૫ ગાણું વધારે) એમોનિયા (૭૩ ગાણું વધારે); બેન્ઝોપાઇરીન નામનો કેન્સર કરતો પદાર્થ (૩.૪ ગાણો વધારે). સરેરાશ ઓરડામાં ધૂમ્રપાનથી થતાં કુલ ધૂમાડાના ૮૫ ટકા ધૂમાડો ફંટાવાળા પ્રવાહથી બને છે. ધૂમ્રપાન-રહિત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૨ પી.પી.એમ. જેટલું હોય છે જે ધૂમ્રપાન કરવાથી ૧૦ પી.પી.એમ. ની આસપાસ થઈ જાય છે.

આ પેસિવ સ્મોકીંગને કારણે સિગરેટ ન પીનાર પણ માત્ર એના ધૂમાડાના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ કેન્સર થવાની શક્યતામાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો થઈ જાય છે. આ જ રીતે ધૂમાડાને કારણે સિગરેટ ન પીનાર વ્યક્તિને હૃદયરોગ થવાની શક્યતા પણ ઉપરાં જેટલી વધી જાય છે. એક જ ઓફિસમાં કામ કરનાર બે વ્યક્તિમાંથી એક સિગરેટ પીતી હોય અને બીજી વ્યક્તિ સિગરેટ ન પીતી હોય તો પણ લાંબે ગાળે પેસિવ સ્મોકીંગને કારણે સિગરેટ ન પીનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ વેરી અસર પડે છે.

આ જ રીતે એક ઘરમાં એક વ્યક્તિ સિગરેટ પીતી હોય તો અન્ય વ્યક્તિઓને પણ એની આડઅસર થાય છે. જે ઘરમાં બાળકો હોય ત્યાં મા-બાપમાંથી કોઈ એક વ્યક્તિ પણ બીડી-સિગરેટ પીતી હોય એ ઘરમાં બાળકોનો વિકસ અન્ય બાળકો કરતાં ઓછો જડપી થાય છે. આવા બાળકને વારંવાર બ્રોન્કાઈટીસ, ન્યૂમોનિયા શરદી-ખાંસી, કાન પાકવો વગેરે અનેક બીમારીઓ થયા જ કરે છે. નવજાત શિશુના અચાનક મૃત્યુ માટે આ ધૂમાડા આંશિક રીતે જવાબદાર હોય એવું જાણવા મળ્યું છે.

આમ, બીડી-સિગરેટ ન પીનારાઓ માટે એનો ધૂમાડો એ સાદા ‘ન્યૂસન્સ’થી ધાણું વધારે ખતરારૂપ છે. કોઈની ‘મજા’ માટે આપણે શા માટે ‘સજા’ ભોગવવી એવો પ્રશ્ન દરેક જાગૃત નાગરિકને થવો જોઈએ. દરેક જાહેર સ્થળોએ બીડી-સિગરેટ ન પીવે એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ તમને પૂછે કે ‘હું અહીં સિગરેટ પીઉ તો તમને કંઈ વાંધો નથી ને? તો આ પ્રશ્નનો સૌથી નમ્ર ઉત્તર હંમેશ માટે ‘હા! મને વાંધો છે’ એવો જ હોવો જોઈએ એમ તમને નથી લાગતું? આપણા જોખમે કોઈના શોખ પોષવાનું તો ન જ પરવતે ને!

## બાળકો અને તરણોને તમાકુથી બચાવો



તમાકુની પેદાશોના અખતરો કરવાની શરૂઆત બાળપણમાં અને કિશોરાવસ્થામાં જ થઈ જય છે. તમાકુનું સેવન કરનારાઓ પૈકી આશરે ૬૦ ટકાથી વધુ લોડોએ એની શરૂઆત ૧૪ વર્ષથી નાની વયે કરી હોય છે. અન્ય કયાંક બીડી સિંગરેટનો ધુમાડો બાળકના શરીરમાં જતો હોય છે અરે એક વર્ષથી નાની ઉમરના બાળકના લોડી પેશાબમાં તમાકુમાંથી મળતા રસાયણો (નિકોટીન)ની હાજરી જણાઈ છે! આવા બાળકો સ્વાભાવિક પણો જ જાણ્યે અજાણ્યે તમાકુના ગુલામ બનવા માંડે છે અને તક મળતાં જ જતે તમાકુના સેવનનો અખતરો કરે છે.

મા-બાપના ધૂમ્રપાનને કારણે બાળકો ઘણી બીમારીઓ ભોગવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ધૂમ્રપાન કરવાથી કસુવાવડ થવાની, ખોડખાપણવાનું મંદબુદ્ધિનું બાળક જન્મવાની શક્યતા ખૂબ વધી જાય છે. એક વર્ષથી નાના બાળકની માતા ધૂમ્રપાન કરતી હોય તો બાળકને ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ થવાની શક્યતા વધી જાય છે. મોટી ઉમરનાં બાળકોમાં પણ માંદગીને કારણે શાળામાંથી રજ વગેરેનું પ્રમાણ જે ધરમાં મા-બાપ ધૂમ્રપાન કરતા હોય ત્યાં વધુ હોય છે. મા-બાપના ધૂમ્રપાનને કારણે બાળક ભણવામાં અન્ય વિદ્યાર્થીઓથી પાછળ રહે છે.

શાળામાં ભાણતાં બાળકો જ તમાકુનુ સેવન શરૂ કરવામાં મુખ્ય હોય છે. આજુબાજુની સંગત, માનસિક અનિશ્ચિતતા, શોખ, વટ કે અખતરો વગેરે અનેક કારણોસર બીડી-સિગરેટ તમાકુનો વપરાશ બાળપણથી શરૂ થઈ જાય છે. લલચામણી જાહેરાતો અને ડિક્ટેટ જેવી સ્પર્ધાઓ સ્પોન્સર કરીને કુમળી વયનાં બાળકોને બીડી-સિગરેટ તમાકુનાં બંધાળી બનાવી દેવાનું અધરું નથી. સિગરેટ પીવાનો અખતરો કરનારાઓમાંથી અડવોઅડધ લોકો કાયમ માટે એના બંધાળી થઈ જાય છે. આ હકીકિત બાળકો નથી જાણતાં પરંતુ સિગરેટ કંપનીઓ બહુ સારી રીતે જાણે છે.

અન્ય એક અભ્યાસમાં નોંધાયું છે કે જે બાળકના મા-બાપ બીડી, સિગરેટ પીતાં હોય એ બાળક બીડી-સિગરેટનું સેવન કરે એવી શક્યતા અન્ય બાળકો કરતા વધારે હોય છે. જો બાળકને એવી ખબર હોય કે એનાં મા-બાપ બીડી-સિગરેટને વિકારે છે તો એ બાળક બીડી, સિગરેટ પીએ એવી શક્યતા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે.


બાળકોને બીડી-સિગરેટ તમાકુના બંધાળ વગર ઉછેરવાં હોય તો આ બધી વસ્તુઓની સામાજિક સ્વીકૃતિ ન રહેવી જોઈએ તમાકુ બીડી સિગરેટ એ એક કુટેવ છે અને જાહેરમાં એનું સેવન કરતા લોકોને શરમ આવે એવું વાતાવરણ ઊભું થવું જોઈએ. બાળકોને મા-બાપ પાસેથી માનસિક હૂંફ દરેક પરિસ્થિતિમાં મળતી રહેવી જોઈએ. લલચામણી જાહેરાતો અને રમતગમત સ્પર્ધાની તમાકુ કંપની દ્વારા થતી સ્પોન્સરશીપ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ૧૮ વર્ષથી નાની વયનાને બીડી સિગરેટ વેચી ન શકાય એવો કાયદો ઘણા દેશોમાં છે, જે વિશ્વવ્યાપી બનાવવો જોઈએ.

જો તમાકુ મુક્ત બાળપણ જશે તો સમાજમાં લાંબે ગાળે તમાકુનો વપરાશ ઘટશે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.

**સિગરેટ પીવાનો અખતરો કરનારાઓમાંથી  
અડદોઅડધ લોકો કાયમ માટે એના બંધાળી થઈ  
જાય છે. આ હકીકિત બાળકો નથી જાણતાં પરંતુ  
સિગરેટ કંપનીઓ બહુ સારી રીતે જાણે છે.**

## તમાકુ કંપની દ્વારા આયોજિત રમતગમત સ્પષ્ટાઈઓ બાળકો અને તરણોને તમાકુના વ્યસની બનાવે છે

‘વીલ્સ’ કપ ડિકેટ ટુનામેન્ટને કારણે શાળામાં ભાણતાં બાળકોની બીડી-સિગરેટ પીવાની વૃત્તિનો અભ્યાસ તાજેતરમાં બ્રિટિશ મેરિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો, જેમાં એવું તારણ નીકળ્યુ હતું કે, ૫.૨ ટકા જેટલાં નવમા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને ટીવી મેચ દરમ્યાન દર્શાવાતી જહેરખબરને લીધે સિગરેટ પીવાની ઈછા થઈ અને ૩.૧ ટકા બાળકોએ ખરેખર સિગરેટ (‘વીલ્સ’ કંપનીની જ!) ખરીદીને પીધી પણ ખરી. આશ્વર્યની વાત તો એ છે કે, કુલ ૧૯૪૮ વિદ્યાર્થીઓ પૈકી મોટાબાગના (૧૪૮૦) વિદ્યાર્થીઓ જાણતા હતા કે સિગરેટનું વ્યસન દારુ અને હેરોઇનના વ્યસન જેટલું જ હઠીલું છે અને સિગરેટ ફૂકવાથી કેન્સર અને હૃદયના રોગો થાય છે.



જે વિદ્યાર્થીઓએ ટીવી પર મેચ અને જહેર ખબર જોઈ હતી એ લોકોમાં સિગરેટ ફૂકવાનું પ્રમાણ ટીવી પર મેચ ન જોનાર વિદ્યાર્થીઓ કરતાં નોંધપણાત્ર રીતે વધુ હતું. વળી, માત્ર છોકરાઓએ સિગરેટ પીધી એવું પણ નથી. છોકરીઓમાં પણ મેચ જોયા પછી ‘વીલ્સ’ સિગરેટ પીવાનું પ્રમાણ લગભગ છોકરાઓ જેટલું જ (૨.૮ ટકા) હતું: ભારતીય સ્ત્રીઓમાં સામાન્ય રીતે સિગરેટ પીવાનું પ્રમાણ ઘણું ઓછું (પુરુષોની સરખામણીએ) હોય છે તે છતાં, જહેરખબરોની અસરથી ભોળવાઈને છોકરીઓએ પણ એટલા જ પ્રમાણમાં સિગરેટ પીધી. ત્યારની ભારતીય ડિકેટ-ટીમનો કોઈ પણ સભ્ય સિગરેટ પીતો નહોતો. તે છતાં ૧૯૪૮ વિદ્યાર્થીમાંથી ૧૧૧૦ વિદ્યાર્થીઓ માનતા હતાં કે ટીમનો ઓછામાંઓછો એક સભ્ય તો સિગરેટ

પીવે જ છે! જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે ભારતીય કિકેટ ટીમનો ઓછામાં ઓછો એક સભ્ય સિગરેટ પીવે છે એમની સિગરેટ પીવાની શક્યતા અન્ય વિદ્યાર્થીઓ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ હતી.

જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે સુનિલ ગવાસ્કર સિગરેટ પીવે છે એમણે એવું ન માનતા વિદ્યાર્થીઓ કરતાં નોંધપાત્ર વધુ પ્રમાણમાં સિગરેટ પીવાનો અખતરો કર્યો હતો! જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે સિગરેટ પીવાથી તાકાત વધે છે અને બોલીગ-બેટીગ-ફીલીગ વગેરે સુધરે છે. એવાં બાળકોએ વધુ પ્રમાણમાં સિગરેટ પીધી હતી. ટી.વી. અને એની જહેરખબર નિયમિત જોનાર બાળકોમાં આવી માન્યતા અન્ય બાળકો કરતાં વધુ પ્રમાણમાં પ્રચલિત હતી!

સિગરેટ પીવાનો અખતરો કરવા માટેના પ્રેરક બળ ઉત્તરતા કમમાં નીચે મુજબ હતાં. (૧) સિગરેટ પીવાથી રમવાની તાકાત વધે છે. (૨) કિકેટરો સિગરેટ પીવે છે. (૩) ટી.વી. પર કિકેટ મેચ જોવી અને (૪) ‘સિગરેટથી આયુષ્ય ઘટે છે’ એ બાબતની અજ્ઞાનતા! આમ, સિગરેટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એવું જાણવા છતાં, ટી.વી. અને એની જહેરખબર જોવાથી બાળકોનાં કુમળાં મન પર સિગરેટ ફૂકવાની અદર્ભ્ય ઈચ્છા જોગ છે અને પરિણામે આટલા મોટા પ્રમાણમાં બાળકો સિગરેટના અખતરા કરે છે!

અન્ય એક અભ્યાસ પરથી એવું નિઃશ્વાસણે સાબિત થયેલું છે કે જેટલી વ્યક્તિ એક વખત પણ સિગરેટ પીવાનો અખતરો કરે છે એમાંથી અડ્ધોઅડ્ધ વ્યક્તિને સિગરેટ પીવાની કાયમી ટેવ થઈ જાય છે! એટલે જો ત ટકા બાળકોએ સિગરેટનો અખતરો કર્યો હોય તો એમાંથી અડ્ધા એટલે દોઢ ટકા બાળકો કાયમ માટે સિગરેટના વ્યસની બની જશે. આખે આખી કિકેટ સ્વર્ધા ર્પોન્સર કરવાનો ખર્ચો કંઈ તમાડું કંપની અમસ્તી તો નહીં જ કરતી હોય ને!! જો એક વખતના ખર્ચથી વર્ષો સુધીના કાયમી ઘરાક તૈયાર થતા હોય તો શું ખોટું છે?

હકીકતમાં કોઈ પણ સિગરેટ કે દાડુની કંપનીને કયારેય કોઈ પણ સ્વર્ધાઓ યોજવા માટે ર્પોન્સરશીપ ન આપવી જોઈએ. આપણા દુર્ભીંયે, માત્ર રૂપિયા મેળવવાની શોધમાં ફરતા આયોજકો અને કરોડો રૂપિયાનો ટેક્ષ સિગરેટમાંથી મેળવતી સરકાર સાચા-બૂરાનો પૂરો વિચાર કરતી જ નથી. કરોડો રૂપિયાનો ટેક્ષ કમાવા પાછળ એનાથી અનેકગણા પૈસા સિગરેટને કારણે બગડતા સ્વાસ્થ્યની સારવાર કરવામાં બગડતી સરકાર સિગરેટ કંપનીની પાવરકુલ લોબી સામે કશું પણ કરવા અસમર્થ છે.

## ખતરનાક ગુટખા અને પાનમસાલાઓ

ભારતીય બજરમાં મળતા પાનમસાલાઓનો અભ્યાસ, તાજેતરમાં, અમેરિકાની જહોન હોપીન્સ પુનિવર્સિટીમાં કરવામાં આવેલો. ભારતમાં મળતા ૩૭ બ્રાન્ડના પાનમસાલામાંથી ઉદ્ બ્રાન્ડમાં એવા પદાર્થો મળ્યા જે શરીરના કોપોનું જનીનિક બંધારણ બદલી શકે અને જેને પરિણામે કેન્સર થઈ શકે!

આવાં ખતરનાક તત્વોનો ધૂમ વેપાર, સરકારની મીઠી નજર હેઠળ ચાલે છે. સરકાર માને છે કે બીડી - સિગરેટ કે તમાકુયુક્ત પાનમસાલા પર કયાંક જીણા અશરે કાનુની ચેતવણી છપાઈ ગઈ એટલે એમનું ડામ પૂરું! લોકોના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એ માટે ન તો પૂરતી જાહેરાત સરકાર તરફથી થાય છે ન તો વ્યસનોમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા લોકોને પૂરતો આધાર મળે છે. પરિણામે એક વખત અજ્ઞાન કે ગેરસમજજ્ઞાને કારણે વ્યસનમાં સપડાયેલ વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમૂક્ત થઈ શકતો નથી.

આ અભ્યાસથી સરકારની આંખ ઉઘડે તો સારું, અને ત્યાં સુધી લોકોએ તો દરેક પાનમસાલાથી ચેતી જવું જોઈએ. મોહુ ખૂલ્લી ન શકે એવો રોગ (સબમ્યુક્સ ફાઈબ્રોસીસ) થી માંડીને કેન્સર સુધીના અનેક રોગો માટે જવાબદાર પાનમસાલાને દૂરથી જ સલામ કરી દેવી આપણા સૌના હિતમાં છે.

ગુટખામાં રહેલ તમાકુને કારણે આજ આપણા દેશમાં મોં અને ગળાના કેન્સરનું પ્રમાણ બીજા બધા કેન્સર કરતાં ઘણું વધારે છે અને હવે થયેલાં નવા સંશોધનો પ્રમાણે માત્ર તમાકુ જ નુકસાન કરે છે એવું નથી. તમાકુ વગરના ગુટખા પણ મોંને ખાસું નુકસાન પહોંચાડી શકે છે. સોપારી, ચુનો, કાથો અને અન્ય પદાર્થો પણ લાંબે ગાળે મોંની અંદરની ચામડીને નુકસાન પહોંચાડે છે. ઘણા ગુટખાના વ્યસનીઓને, લાંબે ગાળે આજ કારણસર મોં ખોલવામાં તકલીફ ઊભી થાય છે. મોં પૂરું ખુલતું નથી અને દુઃખાવો થાય છે. અંગ્રેજમાં સબમ્યુક્સ ફાઈફ્રોસીસ તરીકે ઓળખાતી આ બીમારી ભારતમાં બહુ લોકોમાં જોવા મળે છે અને નિષ્ણાતોના મત પ્રમાણે આ બીમારીનું પ્રમાણ આજકાલ વધતું જાય છે. આ બીમારીને કારણે મોંમાં સહેજ પણ તીખી વસ્તુ જવાથી દુઃખાવો થાય છે; બળતરા થાય છે; મોં પર પરસેવો થઈ જાય છે. આ ઉપરાંત જીભમાં સ્વાદની અનુભૂતિ ઓછી થાય અથવા વિકૃત સ્વાદ અનુભવાય છે, કદક વસ્તુઓ ચાવી નથી શકતી, દાંતની સફાઈ કરવાનું અધરું બને છે, મોં પૂરું ખૂલ્લી નથી શકતું એટલે મોટા કોણિયા બાઈ નથી શકતા, મોંની અંદરની તવચા ફિક્કી પડી જાય અને સામાન્ય ઈજથી લોહી નીકળે છે. મોંમાં સફેદ

ભાગ થઈ જાય છે જે લ્યુકોપ્લેકીયા તરીકે ઓળખાય છે અને કેન્સરના આગમનની ચાડી ખાય છે.

પોતાનો ધંધો ચાલુ રહે એ માટે જાતજાતની બ્રામક જહેરાતો છાપાઓ-હેન્ડબીલો અને પોસ્ટરો દ્વારા કરીને સામાન્ય પ્રજાને દ્વિધામાં મૂકવાના પ્રયત્નો આજકાલ ગુટખા કંપનીઓ કરી રહી છે. સૌથી બેહૂદી અને હાસ્યાસ્પદ દલીલ એવી છે કે ગુટખામાં અનેક આયુર્વેદિક તત્ત્વો છે જે લેવાં દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આ જહેરાત તો એવા પ્રકારની છે કે “અમારા જેરમાં અતિ મુલ્યવાન આયુર્વેદિક ઓષ્ઠધીઓ અને ભસ્મો છે જે વ્યક્તિને મહાન બનાવી શકે છે” જેરમાં હજાર જાતની ઔષ્ઠધી નાંખો પણ એથી કંઈ જેર અમૃતમાં નથી ફેરવાઈ જવાનું! જેરથી માણસ મરે કે બીમાર પડે ત્યારે એમાં રહેલી કોઈ ઔષ્ઠધી એ બીમારી અટકાવી શકવાની નથી. કેન્સર નિષ્ણાતો અને ડેન્ટિસ્ટોનો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે ગુટખા ખાવાથી સબમ્યુક્સ ફાઈબ્રોસીસ, લ્યુકોપ્લેકીયા અને કેન્સર જેવી બીમારી થઈ શકે છે અને ગુટખામાં રહેલ કોઈ ઔષ્ઠધીય તત્ત્વ આ બીમારી થતી અટકાવી શકતું નથી. ગમે એટલાં ગુણકારી તત્ત્વો અંદર હોવા છતાં વર્ષોવર્ષ ગુટખાને કારણે થતી તકલીફીથી વધુને વધુ લોકો હેરાન થાય છે એ સત્ય હકીકત છે, જેને કોઈ કંપની પડકારી શકે એવી સ્થિતિમાં નથી.

બીજો એક બ્રામક પ્રચાર એવો કરવામાં આવે છે કે ગુટખામાં મેળેશ્યમ કાર્બોનેટ નામનો પદાર્થ હોય છે જે એન્ટાસિડ તરીકે કામ કરે છે. એક ગુટખામાં કેટલાં પ્રમાણમાં મેળેશ્યમ કાર્બોનેટ કે અન્ય કહેવતા ગુણકારી તત્ત્વો છે તે તમને ગુટખાના કોઈ પેકેટ પર ક્યારેય જોવા નહીં મળે. પણ જોરશોરથી પ્રચાર થાય છે કે ગુટખામાં મેળેશ્યમ કાર્બોનેટ નામનો એન્ટાસિડ પદાર્થ છે. એન્ટાસિડ પદાર્થ એટલે માત્ર એવો પદાર્થ કે જે પેટના એસિડ સાથે જોડાઈને એસિડની અસર ઘટાડે. એસિડિટિ ના દર્દીઓને એન્ટાસિડ પ્રકારની દવા આપવાની જરૂર પડે પરંતુ તંદુરસ્ત માણસે એન્ટાસિડ લેવાની જરૂર નથી અને ન તો એનાથી તંદુરસ્ત માણસને કોઈ ફાયદો થાય છે. જે વાત ગુટખાની કંપનીઓ સહેલાઈથી ભૂલી જાય છે અને આપણને ભૂલાવવા પ્રયત્નો કરે છે તે એ છે કે ગુટખામાં રહેલ તમાકુ અને અન્ય કેટલાંક પદાર્થો કંઈ ન હોય તેમાંથી એસિડિટિનું દર્દ ઊભું કરે છે અને જેને એસિડિટિ હોય એમને એ વધારી આપે છે. એટલે કે ગુટખામાં ઘણાં તત્ત્વો એવા છે કે જે એસિડિટિની બીમારી કરે છે, અને પછી મેળેશ્યમ કાર્બોનેટ જેવાં થોડાંક તત્ત્વો એસિડિટિ ઘટાડવામાં થોડોક ફણો આપી શકે. ટૂંકમાં, લાઝો મારીને ‘સોરી’ કહેવા જેવી આ વાત છે. પહેલાં નુકસાન પહોંચાડવું અને પછી કહેવું કે અમે તો અમારી

પ્રોડક્ટ (ઉત્પાદન) માં નુકસાન ઘટાડનારાં તત્વો પણ રાખીએ છીએ!! વળી એન્ટાસિડ દવા તરીકે મેળેશ્યમ કર્બોનેટ કરતા ચિહ્નાતી બીજી અનેક દવાઓ છે. જો વધુ માત્રામાં મેળેશ્યમ લેવામાં આવે તો લોહીમાં એનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે મગજને શિથિલ બનાવી શકે છે. દર્દીની કિડની બરાબર કામ ન કરતી હોય તો આવું થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

ગુટખાની કંપનીઓ ત્રીજો એવો પ્રચાર કરે છે કે, ગુટખામાં તમાકુ અને નિકોટીનનું પ્રમાણ બીડી-સિગરેટ કરતાં ઓછું હોય છે. માની લઈએ કે આ દાવો સાચો છે તો એનાથી શું ફરક પડે છે? તમાકુ મૂળે જ ઝેર છે. આ ઝેર અડધો ટકો વધઘટમાં હોય એનાથી એની ઝેરી અસરમાં કોઈ ફરક નથી પડતો. તમાકુ ચાવો, સૂંધો, ચગળો, ફૂંકો, ઘસો - ગમે તે રીતે વાપરો એની ઝેરી અસર તો થવાની જ છે. આજકાલ જે ઝડપે અને જે માત્રામાં ગુટખાનો વ્યાપ વધી રહ્યો છે અને નાના નાના બાળકો તથા સ્ત્રીઓમાં પણ જે રીતે એનો વપરાશ થઈ રહ્યો છે એવો વપરાશ આપણા દેશમાં ક્યારેય બીડી-સિગરેટનો થયો નથી.

દર વર્ષ ગણેશોત્સવ અને નવરાત્રીની ઉજવણી માટે કુલ પાંચ કરોડ રૂપિયાની જહેરાતો ગુટખા કંપનીઓ આપે છે. ગણેશોત્સવ અને નવરાત્રીમાં સંકળાયેલ તરણો અને યુવાનો મંડપમાં નવરા બેઠા બેઠા ગુટખા ખાવાનું શરૂ કરે એ માટે જ આટલી ઉદારતા આવી કંપનીઓ દાખવે છે. આ સર્વબ્યાપી તમાકુ અને ગુટખાના રાક્ષસને હજુ વધુ જોમ અને જુસ્સાથી જાકારો આપવો જરૂરી છે.

ગુટખામાં રહેલ તમાકુ, સોપારી, ચુનો, કાથો  
અને અન્ય પદાર્થો લાંબે ગાળે મોંની અંદરની  
ચામડીને નુકસાન પહોંચાડે છે.

દાણા ગુટખાના વ્યસનીઓને લાંબે ગાળે આ  
કારણસર મોંખોલવામાં તકલીફ ઊભી થાય છે.  
સબમ્યુકસ ફાઇબ્રોસીસ તરીકે અ૦ળખાતી આ  
બીમારી ભારતમાં બહુ લોકોમાં જોવા મળે છે.

## તમાકુ છોડવાના ફાયદાઓ

- તમાકુ છોડ્યા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.
- મૌની ખરાબ અશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.
- આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉમર પહેલાં બીરી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શક્યતા બીરી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડવી થઈ જાય છે.
- તમાકુ છોડ્યા પછી એક જ વરસમાં હૃદયરોગ થવાની શક્યતા અડવી થઈ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હૃદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આપવાની શક્યતા ઘણી ઘણી જાય છે. દશ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શક્યતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઈ જાય છે.
- આર્થિક ફાયદાઓ - બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચોઓ ઘટે.
- સામાજિક ફાયદાઓ - સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

## તમાકુ છોડ્યા પછી શરીર પર થતી સારી અસરો

૨૦ ભિનિટ પછી -	તમાકુથી વધી ગમેલ બ્લાફ્રેશર અને હૃદયના ધબકારા ફરી પાછા નોર્મલ થઈ જાય છે.
૧૨ કલાક પછી -	શરીરમાંથી કાર્બન મોનોક્સાઇડ અને નિકોટીન જેવા ઝેરનું પ્રમાણ ઘટે છે. શરીરમાં ઓક્સિજનનો પૂરવઠો વધે છે.
એક મહિનામાં -	તમારી સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ અનેક ગણી વધી જાય છે, ફેફસું અને શાસનળીઓ ખાંસી ખાઈને સાફ થાય છે અને વધુ તાજી હવા ફેફસામાં જઈ શકે છે.
બે-ગ્રાસ મહિનામાં -	ફેફસાની કાર્યક્ષમતામાં ૩૦ ટકા જેટલો સુધારો થાય છે. શારીરિક શ્રમ કરવાની ક્ષમતા વધે છે. યુવાનીનો અનુભવ.
છ-નાત મહિનામાં -	શાસનમાર્ગની સફાઈ માટે જરૂરી કોષો અને સંરચનાઓનું પૂનઃનિર્માણ થાય છે જેથી ત્યાં ચેપ લાગવાની શક્યતા ઘટે.
એક વરસમાં -	તમને હૃદયરોગ થવાની શક્યતા અડવી થઈ જાય છે. પેરાલિસિસ, ફેફસાં કે અન્ય કેન્સરથી મૃત્યુ થવાની શક્યતા નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે.
પંદર વરસ પછી -	કદી તમાકુ ન લીધું હોય એટલું જ રોગોનું જોખમ રહે છે.

## તમાકુ કષ રીતે છોડશો?

તમાકુનું વસન છોડવું ધ્યાન જ કઠળ કામ છે મોટા ભાગના વસનીઓ છોડવા હશે છે પરંતુ તમાકુની ગુલામીમાંથી છૂટી શકતા નથી. આશરે એંશી ટકા વસનીઓ જિંદગીમાં કયારેક ને કયારેક તમાકુ છોડવાનો પ્રયત્ન કરે છે. એક જ પ્રયત્ને તમાકુ કાયમ માટે બંધ થઈ ગયું હોય એવા કિસ્સા સોએ પાંચ જ જોવા મળે છે. મોટાભાગના સફળતાપૂર્વક તમાકુ છોડનાર વ્યક્તિઓ સેપૂર્ણ સફળતા મેળવતાં પહેલાં ગ્રાણી ચાર વખત ટૂંકા સમય માટે તમાકુ છોડિને ફરી પાછા વસની બન્યા હોય છે.

તમાકુ છોડનારાઓમાંથી ૮૦ ટકા કરતાં વધારે લોકો, પોતાની જાતે જ, બીજા કોઈની મદદ વગર તમાકુ છોડે છે. મોટાભાગના (૮૦ ટકા) લોકો એક આટકે તમાકુનો વપરાશ સંદર્ભ કરીને ગ્રાણ ચાર નિષ્ફળ પ્રયત્નો બાદ સફળ થાય છે. ધીમે ધીમે તમાકુનો વપરાશ ઘટાડતા જઈને તમાકુ છોડવાનું મોટાભાગના લોકોમાં શક્ય નથી બનતું.

તમાકુ છોડવા માટે સૌથી અગત્યની વસ્તુ એ વ્યક્તિની અંદરની હશ્ચા અને એ માટેનું દઢ નિશ્ચયબળ. વ્યક્તિને વિશ્વાસ હોય કે એ તમાકુ છોડી શકશે તો બીજું કોઈ એને અટકાવી શકતું નથી. આ કંઈ રાતોરાત થઈ જાય એવું જાહુઈ કામ નથી. એ એક પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિને પોતાની પ્રકૃતિ મુજબ આ પ્રક્રિયામાં ઓછો વતો સમય લાગે છે. જે રીતે સાયકલ ચલાવવાનું કે ચાલવાનું શીખતાં શીખતાં વારંવાર પરી જવાય છે અને છતાં ફરી ઉભા થઈને ફરી શીખવા લાગીએ છીએ એમ જ તમાકુ છોડતાં છોડતાં વારંવાર નિષ્ફળતા મળી શકે છે અને છતાં દઢ નિશ્ચય હોય તો છેવટની સફળતા મળે જ છે.

તમાકુમાં રહેલ નિકોટીન નામનું તત્ત્વ વસન માટે જવાબદાર હોય છે. નિકોટીનની વસન કરવાની ક્ષમતા દારુ અને હેરોઈન જેવા ડ્રગ્સ કરતાં પણ વધુ છે એવું સાબિત થયું છે. જેવું નિકોટીન મળવાનું બંધ થાય કે તરત જ ચેતા કોષો નિકોટીન મેળવવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે પરિણામે ચેતાતંત્રની કામગીરી સારી રીતે થઈ નથી શકતી. માણસ બેચેની અનુભવે છે, હાથ-પગ-માથું-શરીર દુઃખે છે અને કામમાં ધ્યાન નથી આપી શકતો. પરંતુ, આ અસરો માત્ર એક કે બે અઠવાડિયાં જ રહે છે. જો તમાકુનો વસની એક-બે અઠવાડિયાં ધીરજપૂર્વક થોડીક શારીરિક-માનસિક તકલીફો સહન કરીને નિશ્ચયપૂર્વક તમાકુ બંધ રાખે તો પછી કોઈ તકલીફ થતી નથી.

ઘણા અભ્યાસોથી જાળાયું છે કે તમાકુના સો વસનીમાંથી ૭૫ થી ૮૦ વસનીઓ પોતાનું વસન છોડી દેવાની ઈચ્છા ધરાવે છે અને આશરે ૨૫ જેટલા વસન છોડવા માટે જોરદાર પ્રયત્ન પણ કરે છે. આમાંથી માત્ર પાંચેક ટકા વ્યક્તિ પહેલાં જ પ્રયત્ને સફળતાપૂર્વક વસન છોડી શકે છે. મોટાભાગના વસનીઓને તમાકુનું વસન છોડવા માટે ગ્રાણી ચાર વખત નિષ્ફળતા મળે છે. એટલે કે ગ્રાણ-ચાર વખત ગંભીર પણ પ્રયત્ન કરીને તમાકુ છોડયા પછી કોઈક નબળી ક્ષણે ફરી પાછું તમાકુનું વસન શરૂ થઈ જાય છે. પરંતુ આ અંગે સતત પ્રયત્ન કરનારને છેવટે તમાકુ છોડવામાં કાયમી સફળતા મળે છે.

તમાકુનું વસન છોડવું એ અધરું છે પણ અશક્ય નથી. એ છોડવાની પ્રક્રિયા અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલો તબક્કો તમાકુ છોડવા અંગેની પૂર્વભૂમિકાનો છે; એ પછીનો તબક્કો તમાકુમુક્કિની ધારણા (કોન્ટેમ્પ્લેશન)નો છે; ત્યાર બાદ તૈયારીનો તબક્કો અને છેલ્લે અમલીકરણનો તબક્કો આવે છે. પૂર્વભૂમિકાના તબક્કે દર્દીને મોટીવેશનની (તમાકુ છોડવા માટેના માનસિક બળની) જરૂર હોય છે. એ પછીના તબક્કે માહિતીની જરૂર હોય છે; ત્યાર બાદ કઈ રીતે તમાકુ છોડવું એનો કાર્યક્રમ તૈયારીમાં આવે અને છેવટે તમાકુ છોડવાની તારીખ નક્કી કરી એનો અમલ કરવાની જરૂર ઊભી થાય. આ દરેક તબક્કે વસનીને માર્ગદર્શન, સહકાર અને હુંફની જરૂર પડે છે. જેને કદ્દી વસન છોડવાનો વિચાર જ ન આવતો હોય એને વિચાર આવવા લાગે; જેને વિચાર આવતો હોય એ ગંભીરતાપૂર્વક વધુ માહિતી મેળવે; જેની પાસે માહિતી અને વિચાર છે તે પૂર્વતૈયારી કરતા થાય અને છેલ્લે અમલ કરે. આ દરેક તબક્કામાંથી આગળ વધવા માટે ડૉક્ટરો, કુટુંબીજનો અને મિત્રો અગત્યનો ફણો આપી શકે. એક વખત કહેવાથી વસન બંધ નથી થઈ જવાનું પરંતુ વસન છોડવાની પ્રક્રિયામાં એકાદ પગથિયું આગળ વધી શકાય.

જેમણે એક વખત તમાકુ છોડી દીધું હોય અને ફરી પાછું શરૂ કર્યું હોય એમને માટે ફરીથી તમાકુ છોડવા માત્ર પૂર્વતૈયારી અને અમલીકરણ બે જ તબક્કાની જરૂર પડે છે. ડૉક્ટર તરફથી વારંવાર તમાકુ છોડવા માટે દરેક વસનીને સલાહ આપવામાં આવે તો વસનમુક્ત થનારાઓની સંખ્યા બમણી થઈ જાય છે એવું કેટલાક અભ્યાસોથી જાળવા મળ્યું છે. આ ઉપરાંત, તમાકુનું ભારે વસન ધરાવતા વસનીઓને તમાકુ છોડવા માટે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરપી અને અન્ય દવાઓ દ્વારા ડૉક્ટરી મદદ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિક અભિગમથી વર્ષો જૂનું વસન પણ અઠવાડિયામાં છૂટી જાય છે.

## તમાકુ છોડવા માટે દવાઓ, નિકોટીન પેચ અને સ્યુઇંગામ

તમાકુ છોડવાની દવાઓ કે નિકોટીન અને રિપ્લેસમેન્ટ થેરપી ચામડી પર લગાવવાના પેચ સ્વરૂપે, ચાવવાના ગમ સ્વરૂપે, નાડમાં છાંટવાના સ્રે સ્વરૂપે, ચગળવાની ગોળી સ્વરૂપે કે સુંધવાની દવાના સ્વરૂપે મળે છે. સિગરેટમાંથી મળતા કુલ નિકોટીન કરતાં ગ્રીજા ભાગનું કે અડધા ભાગનું નિકોટીન આ દવાઓમાંથી મળે છે જેથી જે વ્યક્તિને ખૂબ ભારે વ્યસન હોય તેને વધુ પડતી શારીરિક કે માનસિક તકલીફો થતી નથી. ઘણા અત્યાસોથી એવું જાણવા મળ્યું છે કે ભારે વ્યસન ધરાવનાર લોકોની તમાકુ છોડવાની શક્યતા નિકોટીન દવા ધરાવતા પદાર્થ વાપરવાથી બમળી થઈ જાય છે.

શરૂઆતના અડતાલીસ કલાક જો તમાકુ વગર પસાર થઈ જાય તો સફળતાની શક્યતા ખૂબ વધી જાય છે. આ સમય દરમ્યાન નિકોટીન આપીને વ્યસનીનું કામ સહેલું કરી શકાય છે ત્યાર બાદ વધુમાં વધુ આઠ અડવાડિયાં નિકોટીન ધીમે ધીમે ઘટતા ડોઝમાં આપીને બંધ કરવું જરૂરી છે. નિકોટીનનું દવાનો ઉપયોગ સગભૂવસ્થા અને ખૂબ આગળ વધી ગયેલ હદ્યરોગના દર્દીમાં સાચવીને કરવો જોઈએ.

તાજેતરમાં બુપ્રોપાયોન નામની ડિપ્રેશનની સારવાર માટે વપરાતી દવાને અમેરિકા તથા કેનેડામાં તમાકુ છોડવાની દવા તરીકે માન્યતા મળી છે. બુપ્રોપાયોન અને નિકોટીન બંને એક બીજાની તમાકુ છોડવવાની અસરને વધારે છે તેમજ તમાકુ છોડવાથી ઘણાં લોકોમાં વજન વધી જવાની તકલીફ પણ થતી અટકાવે છે. અલબંત, આ દવા ભારતમાં અત્યારે મળતી નથી અને મળે તો પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એને વાપરી નથી શકતી.


કલોનિડીન નામની હાઈબ્લડપ્રેશરની સારવારમાં વપરાતી દવા પણ તમાકુ છોડવવા માટે અસરકારક જણાઈ છે પરંતુ, જે દર્દીને હાઈબ્લડપ્રેશર ન હોય એમને આ દવા આપવાથી બ્લડપ્રેશર ઘટી જવાથી માંડીને ઘણી બધી આડઅસરો થાય છે અને એટલે જ આ દવાનો ઉપયોગ વ્યાપકપણે થઈ શકતો નથી.

મોટાભાગના લોકોમાં તમાકુ છોડવા માટે કોઈ જાતની દવાની જરૂર નથી હોતી અને દઢ મનોબળ જ તમાકુથી છૂટકારો મેળવવા માટે પૂરતું છે.

**મોટાભાગના લોકો એક ઝાટકે તમાકુની વપરાશ સંદર્ભ બંદ કરીને પ્રણામ કરી નિર્ણય પ્રયત્નો બાદ સફળ થાય છે.**

## તમાકુ છોડવાનાં સરળ પગથિયાં

(૧) તમાકુ છોડવાની તારીખ નકદી કરો. જ્યારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઈક દિવસ અગાઉથી નકદી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સંદતર ત્યાગ કરવાનું નકદી રાખો-મનને એ રીતે તૈયાર કરો.



(૨) ફરીથી તમાકુ ખાવાનું મન ન થાપ એ માટે એની કોઈ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો - એશટ્રે - થૂકદાની વગેરેને તિલાજલિ આપી દો.

(૩) પુષ્ટણ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડ્યે ડોક્ટરની સલાહથી નિકોટીન-યુક્ત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું હુઃખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું હુઃખે કે હાથપગ હુઃખે તો એ કંઈ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઈ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જળમાંથી છૂટી જશે.

(૪) કસરત કરો - ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઈચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.



(૫) હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઈ

જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હુંક તમને કામ આવશે. તમારી સમયા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો....


(૬) રૂટીન કામકાજમાં કંઈક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારુ પીનારાને જલદી બીડી-સિગરેટ થાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.

(૭) એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તશુખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંબે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજ ઘણીને ઘુસાડશો.

(૮) બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. ઇ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.

(૯) બીડી-સિગરેટ પીવાના સમયે કંઈક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે.

(૧૦) એક તમાકુમુકત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુકત ગયો એનો આનંદ થવો જોઈએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.



## ૨. દારુની બનાવટ

દારુને અંગ્રેજમાં આલ્કોહોલ કહેવામાં આવે છે અને સામાન્ય વપરાશના રસાયણશાસ્ત્રમાં એ ઈથેનોલ (અથવા ઈથાઇલ આલ્કોહોલ) તરીકે ઓળખાય છે. એની રસાયણિક ફોર્મ્યુલા છે -  $C_2H_5OH$ . દારુની જુદી જુદી બનાવટોમાં જુદા જુદા પ્રમાણમાં ઈથેનોલ અને પાણીનું મિશ્રણ હોય છે.

દારુની બનાવટ	ઈથાઇલ આલ્કોહોલના ટકા
એબ્સોલ્યુટ આલ્કોહોલ	૮૮.૮૫ ટકા
રેકૉફ્ઝાઇડ સ્પેરિટ	૬૦ ટકા
રમ્સ અને લીકર્સ	૫૦ - ૬૦ ટકા
વિલ્સિક, બ્રાન્ડી, જિન	૪૦ - ૪૫ ટકા
પોર્ટ, શેરી	૨૦ ટકા
વાઈન	૧૦-૧૫ ટકા
બિયર	૪-૮ ટકા

૩૪૦ મિ.લિ. બિયર = ૧૧૫ મિ.લિ. વાઈન = ૪૩ મિ.લિ. વિલ્સિક

### દારુની શરીર ઉપર થતી અસરો :

દર વર્ષ વિશ્વભરમાં જેટલા વાહન અક્સમાતો થાય છે એમાંથી અડવોઅડધ અક્સમાત માટે દારુ જવાબદાર હોય છે. આ જ રીતે, મોટાભાગની ઘરની અંદર કે ઘરની બહાર થતી મારામારી અને ખૂન પાછળ પણ દારુ જ જવાબદાર હોય છે. દારુની ખરાબ અસર શરીરના દરેકે દરેક તંત્ર પર થાય છે.

ચેતાંત્ર : દારુ પીવાને કારણે શિક્ષણથી મેળવેલ નિર્ણય શક્તિ; નિરીક્ષણ શક્તિ; એકાગ્રતા અને પ્રતિબાપ ક્ષમતામાં શુક્રમ ઘટાડો થાય છે. વ્યક્તિ જે તે કારણે પ્રવૃત્તમાન વાતાવરણના આવેશમાં આવી જાય છે અને વ્યક્તિ પોતાનો મૂડ કાબૂમાં રાખવા અસમર્થ બની જાય છે. શારીરિક અને માનસિક કાર્યક્ષમતામાં દારુ પીવાથી ઘટાડો થાય છે. જે વ્યક્તિ ટેન્શન-ચિંતાને કારણે સમાજમાં હળભળી ન શકતો હોય અને દારુ લેવાથી શરૂઆતમાં ટેન્શન-ચિંતા ઘટી ગયેલાં જણાય છે, અને બોલવામાં રહેલ માનસિક નિયંત્રણ કે શરમ ઘટી જાય છે.

ઘણાં બધા અભ્યાસોથી સાબિત થયું છે કે દારુ પીવાથી જોવાની ક્ષમતા ઘટી જાય છે. રાતના ફ્રાઇંગ દરમ્યાન દારુ પીવો હોય તો આંખમાં હેડલાઇટનો પ્રકાશ ગયા પછી ફ્રીથી સામાન્ય દેખાવાનું શરૂ થતાં નોર્મલ કરતાં વધુ સમય લાગે છે.

સ્વાદ, ગંધ અને શ્રવણશક્તિમાં ઘટાડો માલ્બૂમ પડે છે. સ્નાયુઓનું અંદરોઅંદર કોઓર્ડિનેશન ઘટે છે. સ્થિર ઊભા રહેવામાં અને કોઈપણ પ્રતિક્રિયા કરવામાં તકલીફ પડે છે. પોતાની લૂલોને નજર અંદાજ કરવી અને કામ કરવામાં વધુ પડતો આત્મવિશ્વાસ દારુ પીવાથી આવે છે જે છેવટે કામની ગુણવત્તા ઘટાડી નાંખે છે.

દારુના લાંબા ગાળાના વપરાશથી મગજ

પર ખૂબ જ ખતરનાક અસરો થાય છે. યાદશક્તિનો નાશ થાય અને શરીરનું બેલેન્સ (સમતોલન) જળવવામાં તકલીફ પડે એ અંગ દારુદિયાનાં લક્ષ્ણણો છે. કાર્સાકોફ અને વર્નાફ્રેસ સિન્ફ્રોમ તરીકે ઓળખાતી બીમારી દારુના અતિ-સેવનના કારણે જ થાય છે. આ બીમારીમાં દર્દી નવી કોઈ વસ્તુ શીખી શકતો નથી અને જૂની વસ્તુઓ પણ ભૂલી જાય છે અને પોતે ભૂલી નથી ગયો એવું દર્શાવવા ખોટી વાતો ઉપજવી કાઢે છે. આ ઉપરાંત, અંખના ડેણાની ગતિ દરેક દિશામાં નથી થઈ શકતી અને શરીરનું સમતોલન જળવાતું નથી. છેવટે ‘આલકોહોલ રીમેન્સીયા’ તરીકે ઓળખાતી મગજ નબળું પડી જવાની તદ્દન અસાધ્ય બીમારી થઈ જાય છે અને દર્દીનું જીવન દોજખ બની જાય છે.



લિવર: દારુની સૌથી વધુ ગંભીર અસર લિવર પર થાય છે. દારુને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થાય છે, લિવર પર સોજે આવે છે અને છેલ્ખે, સાજા ન થઈ શકાય એવી સિરોસિસ તરીકે ઓળખાતી લિવરની ગંભીર તકલીફ ઊભી થાય છે. સિરોસિસ થવાને કારણે લિવરનું મોટાભાગનું કામકાજ ખોરવાઈ જાય છે, પેટમાં પાણીનો લરાવો (જલોદર) થાય છે અને લોહીની ઊલટી થાય છે, જે ક્યારેક જીવલેણ બની શકે છે.

રક્તવાહિનીઓ: દારુ પીવાથી બ્લડપ્રેશર વધે છે. આ ઉપરાંત ચામડીની રક્તવાહિનીઓ પહોળી થાય છે જેને કારણે સહેજ ગરમાવો અનુભવાય છે, પરંતુ એનાથી શરીરની ગરમી જલદી ઘટવા લાગે છે. વધુ પડતી ઠંડીમાં દારુ પીવાથી શરીર વધુ ઠંડુ પડવા લાગે અને અને કારણે મૃત્યુ પણ થઈ શકે.

હૃદય : ““હૃદયની કોરોનરી ધમની સાંકડી થઈ જવાથી આવતા હાર્ટએટેક સામે થોડા પ્રમાણમાં દારુ થોડુંક રક્ષણ આપે છે”” એવી એક શંકાસ્પદ રજૂઆત થાય છે. પરંતુ આની સામે દારુ પીવાથી હૃદયના સ્નાયુઓ ઉપર સીધું નુકસાન થાય છે જે અમૃક દર્દીઓમાં હૃદય પહોળું કરી નાંખીને હૃદયની અસાધ્ય બીમારી ઊભી કરે


ઇ. આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથી તરીકે ઓળખાતી આ અસાધ્ય બીમારી ને લીધે હૃદયનું પમ્પીગ બરાબર થઈ શકતું નથી જેને કારણે સોજા આવવાની અને શાસ ચઢવાની તકલીફો ઊભી થાય છે. દારૂના સેવનથી હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જવાની શક્યતા વધે છે.

જઠર અને પાચન તંત્ર : દારૂ પીવાથી જઠરની અંતઃત્વચાને નુકસાન પહોંચે છે. જઠરના કોષોને એસિડથી બચવામાં શ્વેષ્યસ્તર ઉપર દારૂની સીધી અસરથી ગાબડાં પડે છે જેને લીધે કોષો સુધી એસિડ પહોંચી પુષ્કળ એસિડિટિ કરે છે. એક વખત બરાબર દારૂ પીધા પછી જઠરની અંદર નાના નાના લોહીના ટશિયા ફૂટે છે અને સોજો આવી જાય છે. કાયમી દારૂના વસનીમાંથી ૮૦ ટકા જેટલા લોકોને જઠર પર સોજે અને એસિડિટિ કાયમ માટે રહે છે. એસિડિટિને કારણે કયારેક ઊલટી પણ થાય છે. આ ઉપરાંત લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ અમુકથી વધી જાય તો એની મગજ પર સીધી અસર થાય છે જે ઊલટીની શરૂઆત કરાવે છે. લાંબે ગાળે જઠરના એસિડ બનાવતા કોષો સાવ નાશ પામે એવું પણ બને છે.

આ ઉપરાંત, આંતરડાંની અંતઃત્વચાને નુકસાન થવાથી જાડા થઈ શકે છે. સ્વાદુપિંડ પર ઘણા દારૂદિયાઓને સોજો આવી જવાથી કુંપળીના ભાગે(પેટના સૌથી ઉપરના ભાગે પાંસળીઓ વચ્ચે) સખત દુઃખાવો થવાની તકલીફ (પેન્ઝીએટાઈટીસ) થાય છે.

કેન્સર: લિવર, સ્વાદુપિંડ, અન્નનળી, જઠર, ગળા અને સ્તનનાં કેન્સર થવાની શક્યતા દારૂ પીવાથી ખૂબ વધી જાય છે.

સ્નાયુઓ અને સાંધાઓ : દારૂ પીવાને કારણે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે. વળી જ્યારે વધુ પ્રમાણમાં દારૂ પીવામાં આવે ત્યારે ડિડની દ્વારા યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. લોહીમાં યુરિક એસિડ વધી જાય ત્યારે એ હાથ-પગની આંગળીના સાંધાઓમાં જમા થાય છે અને ખાસ તો પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધા પર અચાનક સોજો અને દુઃખાવો થવા લાગે છે. ગાઉટ તરીકે ઓળખાતો સાંધાનો આ દુઃખાવો દારૂ બંધ કરી દેવાથી ઓછો થઈ જાય છે. હાથ-પગના સ્નાયુઓ નબળા પડવાનું, દુઃખવાનું કે સોજો આવવાનું દારૂને કારણે બને છે જે આલ્કોહોલિક માયોપથી તરીકે ઓળખાય છે.



હાડકાં : દારુ પીવાથી હાડકાંનું કેલ્શિયમ ઘટે છે અને થોડીક ઈજા થવાથી ફેક્ચર થવાની શક્યતા વધી જાય છે. હાડકાંની અંદર અસ્થિમજામાં શેતકણો અને રક્તકણોનું ઉત્પાદન દારુ પીવાથી ઘટી જાય છે.

મૂત્ર-જનન તંત્ર : દારુ પીવાથી પેશાબ વધુ થાય છે. પરંતુ પેશાબ વાટે ક્ષારને બદલે પાણી વધુ નીકળે છે. દારુથી જાતીય આવેગ અને ઈચ્છા વધે છે પરંતુ જાતીય સમાગમ સારી રીતે થઈ શકતો નથી. અન્ય શારીરિક ક્ષમતા ઘટવા સાથે જાતીય-ક્ષમતા પણ ઘટે છે. લાંબે ગાળે નપુંસકતા પણ આવે છે. સ્ત્રીઓ દારુ પીવે તો એમના અંડકોખનું કદ ઘટી જાય છે અને વંધ્યત્વ પણ આવી શકે છે. પ્રસૂતિ વખતે દારુ પીવાથી પ્રસૂતિની પ્રક્રિયા બિનજરૂરી લંબાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન દારુ પીવાથી ખોડાંપણણવાળું બાળક જન્મે છે જેને “ફીટલ આલ્કોહોલ સિન્ઝ્રોમ” કહેવાય છે. કેટલાક આવાં બાળકો માનસિક રીતે કાયમ માટે પણાત રહે છે.

ચામડીની તકલીફ: દારુ પીવાને કારણે સોરીયાસીસ તરીકે ઓળખાતી ચામડીની તકલીફ થવાની શક્યતા વધી જાય છે.


કુપોષણા: દારુ પીવાને કારણે વ્યક્તિ ખોરાક તરફ દુલ્કષ સેવે છે જેને લીધે અનેક જાતનાં વિટામિનની ઊણાપ દારુદિયામાં જોવા મળે છે.

આમ, દારુ પીવાને લીધે અનેક જાતની શારીરિક માનસિક બીમારીઓ આવે છે. દારુ પીવાની લત કે વ્યસન પણ એક પ્રકારની માનસિક બીમારી જ છે જેમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. જેમ અદ્ધીણ કે અન્ય ‘ડ્રુસ’ ના બંધાણીઓ પોતે કુટેવ છોડી શકતા નથી અને કુટેવ છોડવા પ્રયત્ન કરે તો એમનો સાથીદાર ફરીથી શરૂ કરવા આગ્રહ અને જબરજસ્તી કરે છે એમ જ દારુ પીનારા વ્યસનીઓમાંથી ઘણા એ છોડી નથી શકતા અને એટલે એના પ્રચારમાં એનાં ગુણ-ગાન ગાવામાં લાગી જાય છે. અમેરિકાનો એક અંદાજ જણાવે છે કે અમેરિકામાં ૮૦ ટકા લોકો દારુ પીવે છે, ૪૦ થી ૫૦ ટકા જેટલા અમેરિકન પુરુષો અને ત થી ૫ ટકા જેટલી સ્ત્રીઓમાં દારુને કારણે લાંબા ગાળાની તકલીફો ઊભી થાય છે અને આ લોકો અંધું દારુદિયા બની જાય છે. માત્ર ટૂંકા ગાળા માટે પણ વધુ પ્રમાણમાં દારુ પીવાથી મોટાભાગની શારીરિક બીમારીઓ વધી જાય છે અને થોડી માત્રામાં પણ દારુ લેવાથી મોટાભાગની દવાઓની કામગીરી પર વિપરીત અસર પહોંચે છે.

દારુના લાંબા ગાળાના વપરાશથી મગજ અને લિવર પર  
ખૂબ જ ખતરનાક ગ્રેરી અસરો થાય છે.

આ કાતિલને ઓળખી તો....


..દારુને લીધે પગથી માથા સુધી નુકસાન થાય છે.



## દારુનો જીવલેણ ડોઝ

૨૦૦ થી ૩૦૦ મિ.લી. જેટલો એબ્સોલ્યૂટ આલ્કોહોલ એક કલાકની અંદર પીવામાં આવે તો એ જીવલેણ નીવડે છે આટલો આલ્કોહોલ ૧૨ થી ૨૪ કલાકમાં મૃત્યુ નોતરે છે. દારુદિયામાં થતાં મૃત્યુનું કારણ જોઈએ તો દારુદિયામાં સૌથી વધુ મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે અને બીજા નંબરે કેન્સર આવે છે!

## દારુ પીવાથી થતાં (મૃત્યુનાં) જોખમો



- ખૂબ ઠંડીમાં પીવાથી શરીર જલદી ઠંડુ પડી જાય- મૃત્યુ થઈ શકે.
- દારુ શાસનળીમાં જાય તો ન્યૂમોનિયા થઈ શકે.
- ચોકીગ(શાસાવરોધ) થઈ શકે.
- પાતળી હવાને સહન કરવાની ક્ષમતા જતી રહે.
- પડી જવાની અને માથામાં જીવલેણ ઈજા થવાની શક્યતા રહે.
- પાણીમાં પડીને દૂબી જવાની શક્યતા રહે.
- ગોસ ચાલૂ કર્યા પછી સળગાવવાનું ભૂલી જાય જેથી આગ લાગવાની શક્યતા રહે.
- ઇલેક્ટ્રિક ખલગ લગાવતી વખતે ધ્યાન ન રહે અને શોટ લાગે.
- ભૂલથી દવા કે દારુને બદલે એર લઈ લે.
- વાહન અક્સમાત કરી બેસે.

## દારૂથી થતી લિવરના સિરોસિસ અને જલોદરની તકલીફ

જ્યારે કાઈ પણ કારણસર લાંબા સમય સુધી સતત લિવરના કોષોને કાયમી નુકસાન થાય અને પરિણામે લિવરની સામાન્ય સંરચના અને કાર્યપ્રણાલી ખોરવાઈ જાય ત્યારે એ પરિસ્થિતિ “સિરોસિસ” તરીકે ઓળખાય છે. સૌથી વધુ વ્યાપક પ્રમાણમાં સિરોસિસ દારૂના વ્યસનને કારણે થાય છે. દારૂથી લિવરને થતી ઈજા ગણ જુદા જુદા તબક્કામાં જોવા મળે છે. સૌથી પહેલાં લિવરના કોષોમાં ચરબીના કણો જમા થાય છે - ત્યાર બાદ લિવરના કોષો પર સોજો આવે અને ઘણા કોષો નાશ પામે છે. છેલ્લે સુધારી ન શકે એવું કાયમી નુકસાન લિવરના કોષોને થાય છે જે “આલ્કોહોલિક સિરોસિસ” તરીકે પણ ઓળખાય છે.

રોજ સરેરાશ ર૩૦ મિ.લિ. (૧૮૪ ગ્રામ) ઈથાઈલ આલ્કોહોલ એટલે કે રોજની એક બોટલ (૫૦૦ મિ.લિ) વ્હિસ્કી સતત દર્શ વર્ષ સુધી લેનાર વ્યક્તિને લિવરનું કાયમી નુકસાન થઈને “સિરોસિસ” થવાની શક્યતા રહે છે. સરેરાશ વ્યક્તિનું લિવર દરરોજ ૧૭૦ ગ્રામથી વધારે આલ્કોહોલની ચયાપચયની વ્યવસ્થા કરી શકતું નથી. એટલે દરરોજ આનાથી વધુ આલ્કોહોલ લિવરને કાયમી નુકસાન કર્યા કરે છે. સ્ત્રીઓમાં સિરોસિસ થવાની શક્યતા પુરુષો કરતાં વધારે હોય છે. અમુક જનિનને કારણે સિરોસિસ થવાની શક્યતા વધી જાય છે, પરંતુ ચોકક્સ કર્યું જનિન આ માટે કારણભૂત છે એ જાણી શકાયું નથી.

દારૂને કારણે થતા નુકસાનને શરૂઆતના તબક્કાઓમાં ઓળખવાનું ખૂબ મુશ્કેલ છે. શરૂઆતમાં લિવરમાં ચરબી જમા થાય ત્યારે દર્દીને કોઈ તકલીફ નથી જણાતી. દર્દીની દાકતરી તપાસ દરમ્યાન લિવર મોટું થયું છે એવું જાણી શકાય ક્યારેક લિવરના ભાગ પર દબાવવાથી સામાન્ય દુખાવાનો અનુભવ પણ થઈ શકે.

જ્યારે નુકસાન આગળ વધે અને લિવરના કોષો ઉપર સોજો આવી જાય ત્યારે કેટલાંક દર્દીને તાવ આવે. સાથે ભૂખ મરી જવી, બેચેની લાગવી, ઊલટી-ઊબડા થવા, પેટમાં દુઃખવું, પીળિયો (જોન્ડીસ) થવો અને વજન ઘટવું વગેરે લક્ષણો પણ જોવા મળે. લિવર અને બરોળ મોટાં થઈ ગયેલા જણાય છે અને લિવરના ભાગે દબાવવાથી દુઃખે છે. જો આ તબક્કામાંથી દર્દી હેમખેમ સાજે થઈ જાય અને ત્યાર બાદ પણ દારૂ પીવાનું ચાલુ ૪ રાખે તો છેવટનો તબક્કો આલ્કોહોલિક સિરોસિસનો આવે છે.

આલ્કોહોલિક સિરોસિસમાં લિવરને કાયમી નુકસાન થયું હોય છે પરંતુ એનાં લક્ષણો જુદાં જુદાં દેખાય છે. ઘણા લોકોને કોઈ બાધ્ય તકલીફ નથી જણાતી તો બીજા કેટલાડને જીવલેણ કોમા (બેભાનાવસ્થા)ની તકલીફ ઊભી થઈ શકે છે.

સામાન્ય રીતે ભૂખ મરી જવી, વજન ઘટવું અને સ્નાયુઓ નબળાં પડવા (શરીર સૂક્ષ્મ જવું) એ સૌથી પહેલાં જોવા મળે છે. થોડીક ઈજા થાય અને મોટું ચકામું પડી જાય, ખૂબ થાક લાગે વગેરે તકલીફ એ પછી જોવા મળે છે. જ્યારે તકલીફ ખૂબ વધી જાય ત્યારે જલોદર તરીકે ઓળખાતી પેટમાં પ્રવાહી ભરાઈ જવાની તકલીફ દેખા દે છે. દારૂ પીનારાનાં પેટ મોટાં અને હાથપગ એકદમ પાતળા થઈ જવાનું કારણ સિરોસિસ અને એનાથી ઉદ્ભવતી જલોદરની તકલીફ હોય છે. આ ઉપરાંત, કેટલાક દર્દીઓમાં લિવરમાંથી પસાર થતો લોહીનો પ્રવાહ ઢુંધવાને કારણે અન્નનળીની લોહીની શિરાઓ મોટી થઈ જવાની તકલીફ (જે “વેરાઈસીસ” તરીકે ઓળખાય છે) ઊભી થાય છે. ઘણી વખત આ અન્નનળીમાં પહોળી થયેલી રક્તવાહિની ફાટવાથી લોહીની ઊલટી થાય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે.

લિવરની કામગીરી ખોરવાઈ જવાને કારણે લિવરમાં બનતા પ્રોટીન પૂરતા પ્રમાણમાં બની નથી શકતા જે આંશિક રીતે જલોદર કરવા માટે અને પગના સોજા માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત શરીરના કેટલાક અંતઃસ્ત્રાવોનો સમયસર નાશ ન થવાથી સિરોસિસના ઘણા પુરુષ દર્દીઓમાં દાઢી-મૂછના વાળ નીકળી જવા; શુક્કપિંડ નાના થઈ જવા કે છાતીનો ભાગ મોટો થઈ જવા જેવી સ્ત્રોજ્ય અસર દેખાય છે. આ ઉપરાંત હાથની હથેળી રતાશ પડતી થઈ જવી; આંગળીનો છેડાનો ભાગ જાડો થઈ જવો; બરોળ મોટી થઈ જવી વગેરે અનેક ચિહ્નનો દેખાય છે. મોટાભાગના દર્દીઓમાં લિવરની થોડી-ઘણી કામગીરીથી કામકાજ ચાલ્યા કરે છે પરંતુ ક્યારેક જરા સરખી અન્ય માંદગી કે વધુ શ્રમ પહોંચે ત્યારે આપું તંત્ર ખોરવાઈ જાય અને ઘણીવાર દર્દી બેહોશ થઈ જાય એવું બને છે. ઘણી વાર લોહીની ઊલટી થયા પછી દર્દી બેહોશીમાં સરી પડે છે. મોટાભાગના સિરોસિસના દર્દીના મૃત્યુનું કારણ આ હિપેટિક એન્કેલોપથી તરીકે ઓળખાતી બેભાનાવસ્થા જ હોય છે.

લિવરનું સિરોસીસ એ ગંભીર અને લાંબો સમય ચાલતી બીમારી છે એની સારવાર પણ ધીરજ અને કાળજ માંગે છે. લિવરને જે નુકસાન થઈ ચૂક્યું છે એ કદી સારું થવાનું નથી પરંતુ નવું નુકસાન ન થાય અને લિવરની ખોરંભાયેલી કામગીરી વધુ ન ખોરવાય એ માટે સારવાર જરૂરી છે. જ્યારે દર્દીની સ્થિતિ બેભાનાવસ્થાને આરે ઊભેલી હોય કે બેભાન હોય એ સંજોગો સિવાયની બધી પરિસ્થિતિમાં વધુ પ્રોટીન ધરાવતા ખોરાક - (દા.ત. દૂધ, કઠોળ, સિંગ-ચણા વગેરે) દર્દીને આપવા જોઈએ. એ જ રીતે પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહે એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરનાર વ્યક્તિમાં વિટામિનની ઊશપ ખૂબ વ્યાપક પણ જોવા મળે છે. ફળો, લીલી ભાજાઓ, ફણગાવેલાં કઠોળ, અનાજ તથા દૂધની

પેદશોમાં પુજળ વિટામિન મળે છે જે દર્દીને આપવાં જોઈએ. ક્યારેક થાયામિન નામનું વિટામિન ઈન્જેક્શન વાટે ખૂબ વધુ ડોઝમાં આપવાની જરૂરિયાત ઊભી થાય છે. મદ્દી વિટામિનની ગોળી કે કેખ્યૂલ પણ ક્યારેક વિટામિનની પૂર્તિ માટે ઉપયોગી થાય છે.

જો લિવરના સિરોસિસને કારણે જલોદરની તકલીફ ઊભી થઈ હોય તો ખોરાકમાં મીઠું ઘટાડવાની જરૂર પડે છે. સાથોસાથ વધુ પેશાબ થાય એ પ્રકારની દવાઓ પણ જલોદરને કાબૂમાં લેવા માટે આપવી પડે છે. જો ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહી ભરાઈ ગયું હોય અને શાસ લેવામાં તકલીફ જણાતી હોય તો ડોક્ટરની સલાહથી પેટમાંથી પ્રવાહી કઢાવવું પડે છે જેથી તાત્કાલિક રાહત જણાય.

જો લોહીની ઊલટી થતી હોય તો, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને દવાઓ અને ઈન્જેક્શન આપવામાં આવે છે. વારંવાર અન્નનળીની રક્તવાહિની ફૂલી જવાથી લોહીની ઊલટી થયા કરતી હોય એવા દર્દીઓમાં દૂરબીન જેવું સાધન (એન્ડોસ્કોપ) અન્નનળી સુધી ઉતારીને ફૂલી ગયેલી રક્તવાહિનીઓને જલદ ઈન્જેક્શનો આપીને બંધ કરી નાંખવામાં આવે છે. સ્ક્લેરોથેરપી તરીકે ઓળખાતી આ સારવાર ઈમરજન્સીમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી એન્ડોસ્કોપીનો ઉપયોગ વધવાથી સિરોસિસને કારણે થતી લોહીની ઊલટીને ખૂબ સારી રીતે (૬૦ ટકા કેસમાં) કાબૂમાં લઈ શકાઈ છે. તાજેતરમાં એન્ડોસ્કોપની મદદથી લોહી નીકળતું હોય તેવી રક્તવાહિની ઉપર રબર બેન્ડ ચઢાવી દેવાની સારવાર પદ્ધતિ પણ વપરાશમાં આવી છે જે સ્ક્લેરોથેરપી જેટલી જ અસરકારક છે.


વારંવાર લોહીની ઊલટી થતી હોય એવા દર્દીઓમાં બીટા જ્લોકર જૂથની દવાઓ ખૂબ અસરકારક થાય છે અને એન્ડોસ્કોપીથી નસ ફૂલેલી જણાતી હોય એવા દરેક દર્દીમાં ડોક્ટરની સલાહ મુજબ આ સારવાર કરવાથી ફાયદો જણાય છે અને લોહીની ઊલટીને થતી જ અટકાવી શકાય છે. આ ઉપરાંત છેલ્લા ઉપાય તરીકે ક્યારેક મોટું ઓપરેશન કરીને ફૂલી ગયેલ રક્તવાહિનીને શરીરની અન્ય રક્તવાહિની સાથે જોડાડુ કરી આપવામાં આવે છે જેથી રક્તસ્નાવની શક્યતા ઘટી જાય છે.

આ બધી સારવાર કરવા છતાં, દર્દીની જીવનદોરી લંબાવી શકાય છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. સિરોસિસથી પીડાતા દર્દીને સારવારથી થોડીક જ રાહત મળે છે એટલે સિરોસિસ થાય જ નહીં એ માટે દારૂથી દૂર રહેવું જરૂરી છે.

૬૧૩

દારુ પીવેલી હાલતમાં ડ્રાઇવિંગ  
કેવી રીતે જોખમી બને છે? - આમ....


તાત્કાલિક નિર્ણય તેવાની શક્તિ ઘટી જાય.



આરાપાસની વસ્તુ તરફ સહેલાઈથી દ્યાન જોયાય.




પોતાની ગાડીનો જ અકર્માત  
જોખમી ઓપરટેક અને ડ્રાઇવિંગ



દેડલાઈટથી તરત આંઝો અંભાઈ જાય.

લાલ-લીલા રંગનો ભેદ ના પરખાય.



## અડધો અડધ વાહન અક્રમાતો માટે દારુ જવાબદાર હોય છે!

તાજેતરમાં થયેલ એક સર્વે મુજબ વાહન અક્રમાતના કુલ ડિસાઓમાંથી ૫૦ થી ૫૫ ટકા જેટલા ડિસાઓ દારુ પીને પ્રાઈવિંગ કરવાથી થતા હોય છે.

દારુને કારણે માનવ મગજ પર જત જાતની અસરો થતી હોય છે. મુખ્યત્વે માણસની અંદર રહેલ જાત-નિયંત્રણ (Self-control) ઓછું થઈ જતું હોય છે અને માણસ વધુ પડતા આત્મવિશ્વાસથી વર્તતો થઈ જાય છે. ક્રિટનમાં થયેલા એક રસપ્રદ અભ્યાસમાં સૌથી સલામત પ્રાઈવિંગનો એવોઈ જીતેલા પ્રાઈવરોના સમૂહને, દારુ પીધા પહેલાં અને દારુ પીધા પછી પ્રાઈવિંગ ટેસ્ટ આપવાનું કહેવામાં આવ્યું. જે પ્રાઈવરો દારુ પીધા પહેલાં એકદમ સલામત પ્રાઈવિંગ કરતા હતા, તેઓ દારુ પીધા પછી પહેલાં કરતાં અનેક ગણી સાંકડી અને જોખમી જગ્યાએથી બસ હંકારવા લાગ્યા! આમ, દારુ પીધા પછી આ પ્રાઈવરોની સલામત બસ હંકારવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો.

બીજા એક અભ્યાસમાં મોટર ચલાવવાનું શીખતા પ્રાઈવરોને દારુ પાવામાં આવ્યો. જેણે થોડોક પણ દારુ પીધેલ એ પ્રાઈવરો પોતાની મોટરને રસ્તાની વચ્ચોવચ્ચ ચલાવવાની વૃત્તિવાળા થઈ ગયા જ્યારે દારુ ન પીધેલ શિખાઉ પ્રાઈવરો રસ્તાની એક બાજુએ પોતાની સલામતી જોઈને મોટર હંકારતા હતા. ખાસ કરીને અંતર્મુખી (INTROVERT) પ્રતિભા ધરાવતા પ્રાઈવરોમાં દારુની અસર ઘણી વધારે થતી જ્યારે બહિર્મુખી (EXTROVERT) પ્રતિભાવાળા લોકોમાં ઓછી. રસ્તાની વચ્ચોવચ્ચ મોટર ચલાવવા ઉપરાંત દારુને કારણે મગજનો રિએક્શન ટાઇમ (પ્રતિક્રિયા આપવાનો સમય) એટલો વધી જાય છે કે બ્રેક મારવાની શરૂઆત જે સમયે થવી જોઈએ એનાથી મોડી થાય છે, પરિણામે અકરમાત થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

વળી, દારુ પીધેલ પ્રાઈવર પોતાના વાહનના સ્ટીયરીંગ વ્હીલને વારંવાર આમતેમ ધુમરાવ્યા કરે છે. સ્પીડ પણ વારંવાર વતી ઓછી કર્યા કરે છે. કોઈક જરૂર કરતાં પણ ઓછી ઝડપ રાખીને ગાડી ચલાવે તો કોઈક એકદમ ઉડતી ઝડપે.


દારુને કારણે મગજની નિર્ણય શક્તિ (JUDGEMENT) પર પણ ખૂબ અસર પડે અને અચાનક આવી પડતી પરિસ્થિતિમાં દારુન્યો પ્રાઈવર ત્વરાથી નિર્ણય લઈ નથી શકતો જેને પરિણામે રસ્તા પર અચાનક આવી જતા બાળક કે ઢોર-ઢાંખરને બચાવી શકતો નથી. એ જ રીતે અચાનક સામેથી ઓવરટેક કરીને આવતા વાહન સાથે અથડાઈ જવાની શક્યતા વધી જાય છે.

દારુની બીજી અસર આંખો પર થાય છે. આંખની ડીકી પર દારુની અસરને કારણે જ્યારે દારુ પીને હ્રાઈવર રાત્રે ગાડી ચલાવતો હોય ત્યારે એની આંખમાં સામેની ડેડલાઇટનો પ્રકાશ ખૂબ લાંબા સમય સુધી દ્રશ્ય ભરાબર જોવા નથી દેતો.

સામાન્ય તંહુરસ્ત માણસની આંખો પણ તેજસ્વી ડેડલાઇટના પ્રકાશથી અંજાઈ જાય તો થોડો સમય જોવાની તકલીફ પડે છે. દારુંદિયા માટે તો આવી તકલીફ લાંબો સમય રહે છે. આને પરિણામે, પણ રાતના હ્રાઈવિંગમાં અક્ષમાત થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વળી, કેટલાક લોકોમાં દારુ પીધા પછી રંગો ઓળખવાની ક્ષમતા પણ ઘટી જાય છે જેને લીધે સિંનલોને સમજવામાં દારુંદિયા હ્રાઈવરને તકલીફ પડે છે. આમ, દારુ અને હ્રાઈવિંગ બેગાં કરવાથી એક નહી અનેક પ્રકારે વાહન અક્ષમાત થવાની શક્યતા વધી જાય છે. માટે કદ્દી દારુ પીવાનું અને એ પછી હ્રાઈવિંગ કરવાનું બેગું ન કરો.

DON'T MIX DRINK AND DRIVING

## જુવલેણા જોડી - દારુ અને હ્રાઈવિંગ THE DEADLY DUO - DRINKS & DRIVING



## દારુ પીવાથી સ્વાસ્થ્ય સુધરે કે બગાડે?

વારંવાર છાપાંઓ, અન્ય સામાયિકો અને વैજ્ઞાનિક જર્નલ્સમાં એક જુઠાણું છપાયા કરે છે કે “થોડા પ્રમાણમાં દારુ પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે.” આ જુઠાણું ફેલાવનારાઓ ખૂબ પદ્ધતિસર એકની એક વાત જુદા જુદા સ્વરૂપે અને જુદા જુદા સમયે રજૂ કરતા રહે છે જેથી લોકો કોઈ ને કોઈ રીતે એવું સ્વીકારવા લાગે કે દારુથી ફાયદો થાય જ છે. “સો વાર કહેવાયેલું અસત્ય, છેવટે સત્ય તરીકે સ્વીકાર પામે છે” એવી ગોબેલ્સના સિદ્ધાંતને આ લોકો અનુસરે છે. દારુ અંગે જુઠાણું ફેલાવવાનું કાવતસું આંતરરાષ્ટ્રીય સત્રે કામ કરે છે.

૧૯૮૫ની કિસમસના થોડા દિવસ પહેલાં જ બ્રિટિશ સરકારે જાહેર કર્યું કે, રોજનાં ત થી ૪ યુનિટ (એક યુનિટ એટલે આઠ ગ્રામ) આલ્કોહોલ પીનાર પુરુષને અને ૨ થી ત યુનિટ આલ્કોહોલ પીનાર સ્ત્રીને કોઈ “નોંધપાત્ર સ્વાસ્થ્ય સંબંધી જોખમ” ઊભું થતું નથી. એ પહેલાં આ મર્યાદા ઓછી હતી. (અનુક્રમે રોજના વધુમાં વધુ ત અને ૨ યુનિટ.) બ્રિટનની સરકારની આ જાહેરાતનો બ્રિટનના જ મેડિકલ એસોસિએશને વિરોધ કર્યો અને બ્રિટિશ મેડિકલ જર્નલમાં ઘણી ચર્ચા થઈ અને સરકારની જાહેરાત પર માછલાં ધોવાયાં. પરંતુ દારુ બનાવતી કંપનીઓને તો જબરજસ્ત ફાયદો થઈ ગયો અને કિસમસ દરમ્યાન એમનું વેચાણ પણ વધી ગયું!

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સત્રે દારુનું વેચાણ કરનારાઓની એક ખૂબ બળવાન લોભી છે, જે પૈસાના જોરે અનેક રાજકારણીઓ, તબીબો, વैજ્ઞાનિકો વગેરેને નચાવી જાણે છે અને પોતાને માટે લાભદાયક એવા રિપોર્ટ અને ફિતવાઓ કઢાવી લે છે. બ્રિટિશ સરકારની આ જાહેરાત જે રિપોર્ટો ઉપર આધારિત હતી એ મોટાભાગના રિપોર્ટ દારુનું ઉત્પાદન કરતી કંપનીઓ દારા તૈયાર કરવેલા હતા!

માત્ર બ્રિટનમાં જ આવું ચાલે છે એવું નથી. ફાંસમાં દારુના ઉત્પાદકોએ “ફેચ ઇન્સ્ટીટ્યુટ ફોર સાઇન્ટીફિક રિચર્સ ઇન ટુ ડ્રિન્ક્સ” નામની મોટી “વैજ્ઞાનિક” સંસ્થા ઊભી કરી છે જે દર પાંચ વર્ષ જાત જાતના સર્વે કરે છે અને રિપોર્ટ બહાર પાડ્યા કરે છે. નેથરલેન્ડમાં દારુની કંપનીઓએ “ફાઉન્ડેશન ફોર રિસ્પોન્સિબલ આલ્કોહોલ યૂઝ” નામની અન્ય એક સંસ્થા ઊભી કરી છે, જે પણ આવું જ કામ કરે છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધી જગ્યાએ દારુનું ઉત્પાદન કરતી કંપનીઓનાં સીધાં કે આડકતરાં જૂથ છે જે કહેવાતું “સંશોધન” કરીને દારુનો વપરાશ વધે એ માટે પ્રયત્નો કરે છે. એમની દસ્તિએ આવા રિપોર્ટ તૈયાર કરાવીને પ્રસિદ્ધ કરવા એ દારુની જાહેરાતનો જ એક ભાગ છે!

ઘણી વૈજ્ઞાનિક જર્નલોમાં છેલ્લા કેટલાક વખતથી એવી જાતના રિપોર્ટ આવે છે કે, થોડી માત્રામાં દારુ પીનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય, દારુ ન પીનાર કરતાં અને વધુ પડતો દારુ પીનાર કરતાં વધુ સારું હોય છે. હદ્યરોગને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ, કદી દારુ ન પીનાર કરતાં અને ખૂબ દારુ પીનાર એ બંનેની સરખામણીએ, ઓછી માત્રામાં દારુ પીનાર વ્યક્તિમાં ઓછું હોય છે એવો દાવો ઘણા વૈજ્ઞાનિક રિપોર્ટમાં કરવામાં આવે છે. આવા રિપોર્ટનો જીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખરી હકીકત સામે આવી. જે દેશોમાં આવા અભ્યાસ કરવામાં આવે છે ત્યાં સાંસ્કૃતિક દસ્તિએ દારુને સામાજિક સ્વીકૃતિ મળેલી છે, આને પરિણામે ૮૦ ટકા લોકો કયારેક ને કયારેક દારુ પીવે છે. ઉપરોક્ત અભ્યાસમાં જે વ્યક્તિઓ દારુ નહોતી પીતી એ વ્યક્તિઓનો ઇતિહાસ જીણવટથી તપાસતાં માલૂમ પડ્યું કે કાં તો બીમારી ને કારણે અથવા અગાઉ દારુ પીવાથી શારીરિક નુકસાન થયેલું હોવાથી અથવા અન્ય કારણોસર ડોક્ટરે મનાઈ ફરમાવી હોય એવી વ્યક્તિઓ જ દારુ નહોતી પીતી. બાકી બધા લોકો દારુ પીતા હતા. સ્વાભાવિક છે કે મૂળમાં જ શારીરિક રીતે સ્વસ્થ ન હોય એવી વ્યક્તિઓમાં મૃત્યુનું પ્રમાણ અન્ય તંદુરસ્ત (અને બધાની જેમ થોડોક જ દારુ પીનાર) વ્યક્તિ કરતાં વધુ હોય! આમ, દારુ પીવાને કારણે નહીં પણ દારુ ન પીનાર જૂજ વ્યક્તિઓ પહેલેથી બિમાર કે અશક્ત હોવાને લીધે અભ્યાસનું તારણ એવું આવ્યું કે થોડી માત્રામાં દારુ પીનાર વ્યક્તિ વધુ સ્વસ્થ હોય છે. કોઈ રિપોર્ટમાં એવું તો આવ્યું જ નથી કે વધુ માત્રામાં દારુ લેવાથી વધુ ફાયદો થાય છે.

દારુની કંપનીઓ એવો પણ દાવો કરે છે કે દારુ પીવાથી એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધે છે. એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધારે હોય તો એથેરોસ્ક્લેરોસીસ (અને પરિણામે ઉદ્ભલ્પતા હદ્યરોગ, હાઈબ્લડપ્રેશર, પેરેલિસિસ વગેરે) થવાની શક્યતા ઘટી જાય છે. આ અંગે પણ વધુ જીણવટપૂર્વક અભ્યાસ કરતાં જણાયું કે એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનાં બે પ્રકાર હોય છે - એચ.ડી.એલ.<sub>1</sub> અને એચ.ડી.એલ.<sub>2</sub> સ્વાસ્થ્ય માટે ઉપયોગી અસરો મુખ્યત્વે એચ.ડી.એલ.<sub>2</sub> કરે છે જ્યારે દારુ પીવાથી એચ.ડી.એલ.<sub>3</sub> નું પ્રમાણ વધે છે જે એટલું ઉપયોગી નથી. આમ, દારુ પીવાથી ફાયદાકારક એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધતું નથી.

તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલ એક અભ્યાસમાં જુદાં જુદાં પ્રકારના દારુની સ્વાસ્થ્ય પર થતી અસર અંગે તપાસ કરવામાં આવી. વાઈન, બિઅર અને સ્પિરિટ આ ગ્રા પ્રકારનાં દારુ પીવાથી સ્વાસ્થ્ય પર થતી અસરો તપાસતાં કેટલાંક ચોકાવનારાં પરિણામો મળ્યા. આ ગ્રાને પદાર્થમાં આલ્કોહોલ (ઉફ્ફી

દારુ) હોય છે એટલે જો આલ્કોહોલ પીવા માત્રથી કોઈ ફાયદો થતો હોય તો આ ત્રાસમાંથી કોઈપણ પ્રકારનો દારુ પીવાથી એ ફાયદો થાય, પરંતુ અભ્યાસમાં થોડી માત્રામાં પણ (૧) સ્પિરિટ (દિશી દારુ) પીવાથી ફાયદો થવાને બદલે નુકસાન થતું જણાયું; (૨) બીયર પીવાથી કોઈ વિશેષ ફાયદો કે નુકસાન જણાયાં નહીં અને (૩) વાઈન (ખાસ કરીને રેડ વાઈન) પીનારાઓનાં સ્વાસ્થ્યમાં થડોક સુધારો નોંધાયો (હૃદયરોગથી થતાં મૃત્યુનું પ્રમાણ ઓછું જણાયું.) આ અને આની જેવા અન્ય અભ્યાસોથી સ્પષ્ટ થાય છે કે દારુ (આલ્કોહોલ) પીવાથી સ્વાસ્થ્યને કોઈ ફાયદો થતો નથી (નહીં તો કોઈપણ પ્રકારના દારુથી ફાયદો થયો હોત!). વાઈનમાં કેટલાંક એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો હોય છે જે હૃદયરોગ સામે રક્ષણ આપી શકે. રેડ વાઈન દ્રાક્ષમાંથી બનતો દારુ છે. દ્રાક્ષનો જયુસ પીવાથી પણ આ ફાયદાકારક તત્વો મળી શકે. એન્ટિ-ઓક્સિડન્ટ તત્વ મેળવવા માટે વાઈનને બદલે ફળનો રસ કે શાકભાજનો સૂપ પીવાનું વધુ સ્વાસ્થ્યપ્રદ, સસ્તું અને જોખમ-રહિત છે. દારુ પીવાનું હદ બહાર થઈ જવાનું જોખમ કાયમી રહેલું હોય છે અને વધુ માત્રામાં વાઈન પીવાથી પણ નુકસાન જ થાય છે.

આમ, દારુ (આલ્કોહોલ) પીવાથી સ્વાસ્થ્યને કોઈ ફાયદો થાય છે એ વાત સત્યથી વેગળી છે. દારુથી સ્વાસ્થ્યને નુકસાન જ થાય છે અને દારુ અંગેના અત્યાર સુધી પ્રસિદ્ધ થેયેલ બધા અભ્યાસોનો તલસ્પર્શી પુનઃઅભ્યાસ કર્યો પછી હૃદયરોગ અંગેના આંતરરાષ્ટ્રીય પાઠ્યપુસ્તક “હાર્ટ ડિસીજ” (સંપાદક -બ્રાઉનવલ) માં દારુ અંગે અંતિમ વાક્ય લખતાં લેખક કહે છે કે “અત્યારે, હૃદયરોગ કે અન્ય રોગો અટકાવવા માટે દારુનું સેવન શરૂ કરવું જોઈએ એવું લેખકો માનતા નથી”

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ દારુથી ફાયદો થાય કે નુકસાન એનો ખૂબ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે એનું તારણ “કેટલાક દારુને કારણે હૃદયરોગથી થતાં મૃત્યુમાં થોડોક ઘટાડો થાય છે પરંતુ એની સામે ઈજા, લિવરની બીમારી(સિરોસિસ), સ્વાહુપિંડનો સોજો, અને માનસિક બીમારીથી થતાં મૃત્યુનું પ્રમાણ ખૂબ વધી જાય છે. દારુ પીવાથી અટકાવી શકાતાં કુલ મૃત્યુ કરતાં એ પીવાથી થતાં કુલ મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે છે. સમાજમાં મૃત્યુ જેટલી જ અગત્યતા ઉત્પાદક શ્રમ કરી શકવાની ક્ષમતા છે. દારુને કારણે ઉદ્ભવતા રોગોનું સમાજ પર એટલું બધું ભારણ વધે છે કે સમાજના ઘણા લોકો ઉત્પાદક શ્રમ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તમાકુથી ઉદ્ભવતી બીમારીઓના ભારણ કરતાં પણ વધુ પ્રમાણમાં દારુથી ઉદ્ભવતી બીમારીઓનું ભારણ સમાજમાં જોવા મળે છે.”

## જ્યાં દારુની ઉપલબ્ધતા મર્યાદિત હોય છે

### ત્યાં દારુ - સંબંધિત પ્રશ્નો પણ ઓછા હોય છે.

સંપૂર્ણ દારુબંધી હોવી જોઈએ; દારુ મર્યાદિત પ્રમાણમાં લાયસન્સ - પરમીટ પર મળવો જોઈએ; કે છૂટથી જેને અને જ્યાં જોઈએ ત્યાં મળવો જોઈએ? આ અંગેનો વિવાદ માત્ર ગુજરાતમાં જ ચાલે છે એવું નથી પણ વિશ્વના અનેક દેશોમાં અને રાજ્યોમાં દારુપ્રેમી અને દારુવિરોધીઓ કાયમ માટે આ પ્રશ્ને ચર્ચા કર્યા કરતા હોય છે. દારુથી શારીરિક અને સામાજિક સ્વાસ્થ્ય - સંબંધી નુકસાન થાય છે એ વાત નિર્વિવાદ છે. પરંતુ કેટલાક લોકો દલીલ કરતાં કહે છે કે દારુબંધી દૂર કરવાથી કોઈ વધારાનું નુકસાન નહીં થાય કારણ કે અત્યારે પણ દારુ ગુજરાતમાં છૂટથી મળે છે! આ દલીલ અંગે અન્ય દેશોના અનુભવ જોઈએ તો જ આપણે સાચી હકીકત સમજી શકીએ.

આ વિષય પર અમેરિકાના “જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન”ના માર્ચ ૧૯૮૬ ના અંકમાં એક રસપ્રાદ પ્રશ્નોત્તરી રૂપે લેખ પ્રસિદ્ધ થયો છે. આ લેખમાં ‘દારુની ઉપલબ્ધતા અને દારુ-સંબંધિત પ્રશ્નો’ અંગે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ૨૪ જેટલા જુદા જુદા વૈજ્ઞાનિક રિપોર્ટ ટાંકવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિક માહિતીનો આધાર લઈને તૈયાર કરેલ લેખમાં સ્પષ્ટપણે જણાવે છે કે જ્યાં દારુની રેલમછેલ હોય છે - દારુ ખૂબ છૂટથી મળતો હોય છે - ત્યાં દારુ પીવાનું પ્રમાણ અને દારુના કારણો ઉદ્ભબતા પ્રશ્નોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ હોય છે. ઘણા અભ્યાસોથી એ સાબિત થયું છે કે દારુની છૂટથી ઉપલબ્ધ દારુ પીવાનું પ્રમાણ વધારે જ છે. જ્યાં દારુ છૂટથી મળે છે ત્યાં દારુદિયાઓનું દારુ પીને વાહન ચલાવનારાઓનું, અક્રમાત, મારામારી અને દારુ-સંબંધિત લિવરના પ્રશ્નોનું પ્રમાણ વધારે હોય છે.

જે રાજ્યોમાં પહેલાં દારુ છૂટથી મળતો હોય ત્યાં સરકારી પ્રતિબંધ કે અન્ય કારણસર (દા.ત. યુદ્ધને કારણે) દારુ મળવાનું બંધ થઈ જાય ત્યારે દારુ- સંબંધિત લિવરના રોગો તથા અક્રમાતોનું પ્રમાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે. એ જ રીતે મારામારી, ઘરેલું જગડાઓ વગેરેનું પ્રમાણ પણ દારુની ઉપલબ્ધતા ઘટવા સાથે ઘટે છે.

આથી ઊલદું, જ્યાં દારુબંધી હળવી કરવામાં આવે છે ત્યાં દારુ પીવાનું અને દારુ સંબંધિત પ્રશ્નોનું પ્રમાણ પણ વધી જાય છે. દારુબંધી હળવી કરવાથી દારુ ન પીનાર અને ભાગ્યે જ પીનાર વ્યક્તિ વધુ દારુ પીવા લલચાય છે, એટલું જ નહીં અંગ દારુડિયો પણ પહેલાં કરતાં વધુ દારુ પીવા લાગે છે. દારુની વ્યાપક

ઉપલબ્ધતાને કારણે યુવાનોમાં એવી લાગણી ફેલાય છે કે દારુને સામાજિક સ્વીકૃતિ મળેલ છે અને દારુ પીવામાં કશું ખોટું નથી. વ્યાપક ઉપલબ્ધતાને કારણે જ આજે અમેરિકમાં ઘણાં લોકો દારુ પીવાને કારણે થતાં લાંબા ગાળાના નુકસાનો ભોગવે છે.

## દારુની બોગસ પરમીટો બંધ કરો

ગુજરાતમાં વર્ષોથી દારુબંધી હોવા છતાં “સ્વાસ્થ્ય” ના નામે દારુની પરમીટ કાઢી આપવામાં આવે છે. આધુનિક તબીબીશાસ્ત્રની કોઈ ચોપડીમાં સ્વાસ્થ્ય માટે કાયમ દારુ પીવો જોઈએ એવું લખેલ નથી. લક્ષણી લેરી અસર થઈ હોય એવા કેસ સિવાય બીજી કોઈ પણ પરિસ્થિતિમાં દવા તરીકે મૌં વાટે દારુ પીવાની જરૂર પડતી નથી. લોકો શરદીથી માંડીને હૃદયરોગ સુધીની અનેક તકલીફિમાં ખોટેખોટો દારુનો ઉપયોગ કરવા લાગે છે અને જાણે અજાણે દારુના વસની બની જાય છે. દારુની “હેલ્થ પરમીટ” આપવાની પ્રથા જ તદ્દન બોગસ છે અને બ્રાષ્ટાચારની જનની છે. દારુબંધી રાખવી હોય તો આવી ‘હેલ્થ પરમીટ’ ને તાત્કાલિક પાછી જેંચી લેવી જોઈએ અને કડકાઈથી અમલ કરવો જોઈએ.

દારુને કારણે લિવર, હૃદય, મગજ અને અન્ય અવયવોને થતી ખરાબ અસરો; તથા ઉદ્ભબતા અકસ્માતોનું પ્રમાણ એટલું ખોટું છે કે “દારુ-સંબંધિત કારણો” એ વિશ્વમાં થતાં કુલ મૃત્યુનાં કારણોમાં ત્રીજા નંબરે છે. વિશ્વના કુલ વાહન અકસ્માતમાંથી અડધોઅડધ અકસ્માતોનું કારણ દારુ હોય છે. કરુણ વાત એ છે કે દારુ પીનાર અકસ્માત કરે છે અને દારુ ન પીનારા મૃત્યુ પામે છે! (આ એક જ રોગ એવો છે કે જેમાં રોગીની સાથે સાથે સમાજના અન્ય વ્યક્તિઓ પણ કમોતે ભરે છે.) એક અંદાજ પ્રમાણે ભારતમાં દર દશ હજાર વાહને હું મૃત્યુ વાહન અકસ્માતથી થાય છે. એક દારુદિયો પોતાની ઉપરાંત પોતાના કુટુંબ, સમાજ અને અન્યને કાયમી નુકસાન પહોંચાડી શકતો હોય ત્યાં દારુની સ્વાસ્થ્ય-સંબંધિત અસરનો પૂરો અંદાજ મેળવવો જ મુશ્કેલ થઈ પડે છે.

**જ્યાં દારુબંધી હળવી કરવામાં આવે છે ત્યાં દારુ પીવાનું અને  
દારુ સંબંધિત પ્રજ્ઞનોનું પ્રમાણ પણ વધી જાય છે.**

**દારુબંધી હળવી કરવાથી દારુ ન પીનાર અને ભાગ્યે જ  
પીનાર વ્યક્તિ પણ વધુ દારુ પીવા લલચાય છે.**

## શું તમે આલ્કોહોલિક છો?

તમે જો દારુ પીતા હો તો તમને દારુ છોડવા માટે મદદની જરૂર છે કે નહીં એ જાગવા માટે આલ્કોહોલિક એનોનિમસ દ્વારા તૈયાર થયેલ આ સાથેના પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકો છો. (જો તમારા હરેક પ્રશ્નનો ઉત્તર ‘ના’ માં હોય તો તમારા નિકટના કોઈ સ્નેહીની મદદ લઈ ફરી પ્રશ્નોના ઉત્તર આપો.)


(હા) (ના)

- ૧) દારુ પીવાના કારણે તમારા કામના સમયનો વ્યય થાય છે? ( ) ( )
- ૨) મધ્યપાનની આદત તમારા કૌટુંબિક જીવનને દુઃખી બનાવે છે ( ) ( )
- ૩) શરમાળ સ્વભાવને કારણે પીઓ છો? ( ) ( )
- ૪) દારુ પીવાને કારણે તમારી પ્રતિજ્ઞાને આંચ આવે છે? ( ) ( )
- ૫) દારુ પીધા પછી તમે પશ્ચાતાપની લાગણી અનુભવો છો? ( ) ( )
- ૬) મધ્યપાનના પરિણામ રૂપે કોઈવાર તમે આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છો? ( ) ( )
- ૭) પીતી વખતે તમારાથી નીચલા સ્તરના લોકો સાથે હળવા લાગો છો? ( ) ( )
- ૮) પીવાના કારણે તમે કૌટુંબિક હિત પરત્યે દુર્લક્ષ કર્યું છો? ( ) ( )
- ૯) દારુના સેવનના પરિણામે તમારી મહત્વકાંશા ઘટવા લાગી છે? ( ) ( )
- ૧૦) અમુક નિશ્ચિત સમયે દરરોજ દારુની તલપ લાગે છે? ( ) ( )
- ૧૧) રાત્રે પીધા પછી ફરી બીજા દિવસે સવારે તમને દારુ જોઈએ છે? ( ) ( )
- ૧૨) પીવાને કારણે ઊંઘની બાબતમાં સમસ્યાઓ ઊભી થાય છે? ( ) ( )
- ૧૩) દારુ પીવાનું શરૂ કર્યા પછી તમારી કાર્યક્ષમતા ઘટવા લાગી છે? ( ) ( )
- ૧૪) મધ્યપાનથી તમારી નોકરી કે ધંધામાં સમસ્યા ઊભી થઈ છે? ( ) ( )
- ૧૫) ચિંતા કે મુશ્કેલીમાંથી બચવા માટે દારુ પીઓ છો? ( ) ( )
- ૧૬) એકલા દારુ પીઓ છો? ( ) ( )
- ૧૭) મધ્યપાનના પરિણામે કોઈવાર તમને વિસ્મૃતિ થઈ છે? ( ) ( )
- ૧૮) દારુના અતિસેવનના પરિણામે કોઈવાર દાકતરી ઈલાજ કરાવ્યો છે? ( ) ( )
- ૧૯) તમારો આત્મવિશ્વાસ વધે એટલા માટે પીઓ છો? ( ) ( )
- ૨૦) દારુના સેવનના પરિણામરૂપે તમારે હોસ્પિટલ જવું પડ્યું છે? ( ) ( )

જો તમે ઉપરના સવાલોમાંથી એકનો ઉત્તર પણ “હા” માં આપ્યો હોય તો અહીં એક “નિશ્ચિત ચેતવણી” છે કે તમે મધ્યાસકત (દારુપ્રેમી) હોઈ શકો. તમે ત્રણ કે વધારે પ્રશ્નના ઉત્તર “હા” માં આપ્યા હશે તો તમે ચોક્કસ આલ્કોહોલિક (દારુદિયા) છો.

## દાર્ડિયા બનવાની પ્રક્રિયાના તબક્કાઓ

- શરૂઆતમાં દારુના વ્યસનને કારણે માનસિક આનંદ મળે છે. દારુ સંબંધિત વાતો-ચર્ચા મિત્રપર્તુળમાં થયા કરે. ત્યારબાદ દારુની અસર હેઠળ વિકિત કેટલીક વર્તણુક કરે છે જે તેને જરા પણ યાદ રહેતી નથી.
- એ પછી આખો દિવસ દારુ પીવાના વિચારો આવ્યા કરે છે. ક્યારે જલદી સાંજ પડેને દારુ મળે?; દારુ માટે કોની પાસેથી પેસા મળશે?
- દારુ સંબંધિત વાત કરવાનું ટાળવા લાગે.
- જાત પરના નિયંત્રણનો સંપૂર્ણ અભાવ. કોઈ પણ સમયે, કોઈ પણ રૂથળે, કોઈ પણ પ્રસંગે દારુ પીવાની ઈચ્છા અને એનો અમલ થાય.
- દારુ પીવા માટેનાં બહાનાં અને કારણો (દા.ત. દુઃખી લગ્ન જીવન; ટેન્શન; મિત્રપર્તુળનું દબાજા) આગળ ધરવામાં આવે.
- દારુ છોડવાના વર્થ્ય પ્રયત્નો. થોડા સમય માટે દારુ બંધ કરવાનો આવેશ અને પછી હતા ત્યાં ને ત્યાં.
- ઓછી તીવ્રતાવાળો દારુ પીવાના વર્થ્ય પ્રયત્ન.
- દિવસોના દિવસો સુધી માત્ર દારુ જ પીવો - ખાવું પીવું કે અન્ય કોઈ સામાજિક - વ્યાપસાયિક કામ ન કરવું.
- આવક બંધ થઈ જવાથી જૂહું બોલીને; ચોરી કરીને કે કોઈ પણ ગેરકાનુની રસ્તા લઈને દારુ મેળવવાનો પ્રયત્ન
- કુટુંબીજનો, પત્ની, મિત્રો વગેરે સામે શંકાશીલ બની જવું. પોતાની સામે કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે એવું લાગ્યા કરવું.
- ચાલવા, ઉઠવા, બેસવામાં લથડીયાં ખાવાં.
- સંપૂર્ણ માનસિક અસ્વસ્થતા.
- લિવરની કે પેટની અન્ય બીમારી અને સંપૂર્ણ શારીરિક અસ્વસ્થતા.
- મૃત્યુ.



## દારુ બંધ કરવો હોય તો શું કરવું?

દારુની આદતમાં ફ્સાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જૂની સોબત, જલદીથી છૂટી નથી શકતી અને દારુને લીધે તન-મન-ધન અને કુટુંબથી ખુંવાર થઈ ગયેલ માણસને ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરતાં કરતાં આંખે પાણી આવી જાય છે. દારુના વ્યસનીએ વ્યસનને કાયમ માટે તિલાંજલી આપવી હોય તો માત્ર દારુ પીવાનું બંધ કરવાથી એ કામ શક્ય નહીં બને. દારુ બંધ કરવાની સાથે સાથે જ અથવા એ પહેલાંથી જીવનની ગુણવત્તા સુધારવા માટેનાં ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જકારો આપવા માટે અતિઆવશ્યક છે. વ્યસનમુક્તિને પરિણામે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું પુનઃનિર્માણ થવું જ જોઈએ. જો આ દરેક જાતની સ્વાસ્થ્યપ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે તો ઘોડાક જ વખતમાં દારુનું વ્યસન પાછું ચાલુ થઈ જાય છે.

આમ, કાયમી વ્યસનમુક્તિ માટે દારુ છોડવાની સાથોસાથ જ નીચેની બાબતોનો અમલ કરવો જરૂરી છે.

- શારીરિક સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
- વધુ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક આહાર ખાવો.
- નિયમિત ઊંઘ લેવી.
- શવાસન-ધ્યાન-યોગાસન કરવાં.
- જીવનને મૂલ્યનિષ્ઠ બનાવવું.
- સમયસર કામ પર જવું, દૈનિક કાર્યક્રમનું સમયબદ્ધ આયોજન રાખવું.
- જાતની ઓળખ સુધારવી-સ્વમાની બનવું.
- જવાબદારી સ્વીકારોને નિભાવવી
- કુટુંબ સાથે વધુ સમય ગાળવો
- કુટુંબનો આધાર બનવા પ્રયત્ન કરવો
- સર્વશક્તિમાન કુદરત કે ભગવાન પર શ્રદ્ધા રાખવી
- પ્રાર્થનાની શક્તિને અનુભવવી.

દારુ બંધ કરવાની સાથે સાથે જ જીવનની ગુણવત્તા  
સુધારવા માટેના ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી  
જકારો આપવા માટે અતિઆવશ્યક છે.

## દારુ છોડવાથી તાત્કાલિક ઉદ્ભવતી નાની મોટી તકલીફોને ઓળખી લો:

લાંબા સમય સુધી દારુનું વ્યસન થઈ ગયા પણી દારુ પીવાનું અચાનક બંધ કરી નાંખવાથી હાથ-પગમાં પ્રૂજારી, હદયના ધબડારા જડપથી ચાલવા, શરીર ગરમ લાગવું, ઊંઘ ન આવવી, ખરાબ સ્વખ આવવા, ચિંતા થવી, અચાનક ગબરાટ થવો અને પેટમાં ગરબડ થવી વગેરે લક્ષણો જોવા મળે છે. આ બધાં લક્ષણોની શરૂઆત દારુ બંધ કર્યા પણી દશેક કલાકમાં થઈ જાય છે. લક્ષણોની તીવ્રતામાં શરૂઆતના બે દિવસ વધારો થયા કરે છે અને ચોથે - પાંચમે દિવસે તીવ્રતા ઘટવા લાગે છે. ચિંતા અને અનિદ્રાની તકલીફ કયારેક મહિનાઓ સુધી ચાલુ રહે છે. કેટલાંક દર્દીઓમાં દારુ છોડવાથી ભારે માનસિક લક્ષણો જણાય છે જેમાં દર્દીને જાતજાતની બિહામણી અભિષાંસો થયા કરે છે અને મનમાં ભારે ગૂંચવાડો રહે છે. બહુ ભાગ્યે જ દારુ બંધ કરવાને કારણે જેંચ આવે એવું પણ બનતું હોય છે. અહીં દારુ છોડવાથી ઉદ્ભવતી તકલીફોની યાદી આપી છે જે દારુ છોડવાની ઈચ્છા ધરાવનારાઓ એ ધ્યાનમાં રાખી આમાંથી કોઈ લક્ષણો જણાય તો ખોટો ગબરાટ ન કરવો જોઈએ

- બેચેની, અશક્તિ
- ભૂખ મરી જવી (પેટમાં-કુંપળીમાં બળતરા / દુખાવો; ઊલટી-ઊલકા; ખાટા ઓડકાર)
- અનિદ્રા, ચિંતા
- હતાશા (આપધાતના વિચારો)
- જાતીય ઈચ્છાનો અભાવ (કયારેક નપુંસકતા કે વહેલા વીર્યમ્ભાવની તકલીફ)
- હાથ-પગમાં ઝાંઝાંઝાટી થાય / ખાલી ચઢે / બળતરા થાય
- હાથ-પગ પ્રૂજે
- ચકકર-અસંતુલન
- માથું દુઃખે
- ચિત્તભ્રમ (જ્યાં કંઈ ન હોય ત્યાં જાતજાતનું કંઈક દેખાય અને ન હોય ત્યાં અવાજ સંભળાય; ચામડી પર કંઈક ચાલતું હોય એવો ભ્રમ થાય)
- યાદ ન રહે, એકાગ્રતાનો અભાવ
- વધુ પડતી લાગણીશીલતા અથવા કયારેક લાગણીશૂન્યતા
- શારીરિક અવયવોના સંકલનનો અભાવ
- ચીડિયાપણું, વધુ પડતો ગુસ્સો

## દારુ છોડવા માટેનાં પગથિયાં:

(૧) મનને દારુ છોડવા માટે તૈયાર કરો: કોઈપણ વ્યસનથી મુક્ત થવા માટેનું સૌપ્રથમ પગથિયું છે મનને વ્યસન છોડવા માટે તૈયાર કરવાનું! દંડ મનોબળ અને ઈચ્છાશક્તિ વગર કોઈ પણ વ્યસન છોડવાનું અશક્ય છે. જ્યાં સુધી મન તૈયાર નહીં થાય ત્યાં સુધી કોઈપણ બાધ્ય દબાણ દારુ છોડવી નહીં શકે.

(૨) દારુ છોડવા માટે નાનાં નાનાં પગથિયાં નક્કી કરો:- પહેલાં જ દિવસથી કશયમ માટે દારુ છોડવાનું અશક્ય લાગતું હોય તો એક કલાક કે એક દિવસ માટે દારુ છોડવાનું નક્કી કરો. માત્ર આજનો દિવસ હું દારુ નહીં પીઉ એમ નક્કી કરીને એને દફ્તાપૂર્વક વળગી રહો. ગમે એટલી તલપ લાગે કે લાલચ જાગે પણ આજે તો હું નહીં જ પીઉ એટલું નક્કી રાખો. ધીમે ધીમે દારુની તલપ કઈ રીતે ટાળવી એ તમે શીખી જશો અને પછી દારુ વગરના દિવસોની સંખ્યા વધારતાં જરા પણ વાર નહીં લાગે.

(૩) દારુ છોડયા પછી એ પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવે ત્યારે....: દારુ છોડયા પછી અચાનક એ પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. આવા સમયે,

(અ) આ તીવ્ર ઈચ્છાને થોડાક કલાક માટે મુલતવી રાખવાનું આયોજન કરો. જ્યારે રોકી ન શકાય એવી તલપ લાગે ત્યારે થોડાક સમય માટે જ્યાં દારુ પીવાનું શક્ય જ ન હોય એવા સ્થળે (દા.ત. મંદિરમાં કે કોઈ નિર્યસની મિત્રના કે ગુરુના સાનિધ્યમાં) જતા રહેવું. કલાક બે કલાકનો સમય પસાર થઈ ગયા પછી મનની સ્થિતિ ફેરવાઈ ગઈ હશે.

(બ) દારુ પીવાની રોકી ન શકાય એવી તીવ્ર ઈચ્છા થાય ત્યારે તમે છેલ્લે દારુ પીને કરેલું બેહૂદું, શરમજનક અને નુકસાનકારક વર્તન યાદ કરી લેજો. ફરીથી દારુનો એક પણ ઘૂંટ આ જ પરિસ્થિતિ તરફ લઈ જશે એ ચોકકસ છે એનું ધ્યાન રાખશો. મિત્ર, નોકરી, પત્ની કે પૈસા ગુમાવવાની દુઃખભરી સ્થિતિ દારુને કારણે ઊભી થાય છે એ ભૂલશો નહીં. એક કાગળ પર આવા અનુભવોની નોંધ રાખો અને એની નકલ કાયમ બિરસામાં રાખો મૂકો. જ્યારે દારુ પીવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે આ ચબરખીમાં દારુ સાથે સંકળાયેલ તમારો પોતાનો ભૂતકાળ વાંચીને યાદ કરી લેજો. પછી મન સાખૂત હશે તો કદી ફરીથી પીવાની હિંમત નહીં થાય.

**(૪) ડોક્ટરે દાડુ છોડવા માટે દવા આપી હોય તો નિયમિત લેવી :** કેટલીક દવાઓ એવી આવે છે જે નિયમિત લેનાર વ્યક્તિ, જો દવા ચાલુ હોય ત્યારે દારૂનું સેવન કરે તો અનાથી આનંદ મળવાને બદલે ન ગમતી તકલીફો ઊભી થાય છે. ‘ડાઈસફ્ટીરામ’ નામની આ દવા અને દાડુ ભેગા થાય ત્યારે, હાથ પગની ધૂજારી, ચક્કર, ઊલટી, ઊબડા, ઝડા વગેરે તકલીફો થાય છે. (અલબત્ત હાઈબ્લડ્પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ કે પેરાલિસિસના દર્દીઓમાં આ દવા વાપરી શકાતી નથી). આવી તકલીફ થવાને કારણે દારૂનો વ્યસની ફરીથી દારૂને હાથ લગાવવાનો વિચાર પણ કરતો નથી. આ દવા ખૂબ જૂના બંધાળીને દાડુ છોડવાના શરૂઆતના દિવસોમાં ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગી થઈ શકે છે. કુમળા છોડને શરૂઆતના દિવસોમાં જે રીતે વાડના રક્ષણની જરૂર હોય છે, એ જ રીતે બંધાળીને વ્યસનમુક્તિના શરૂઆતના દિવસોમાં ફરીથી દાડુ શરૂ કરતો અટકાવવા માટે આ દવા ઉપયોગી થાય છે.

**(૫) જીવનની જૂની બેઢંગી રહેતારમાં પરિવર્તન લાવો:** વ્યસન છોડવાની સાથે જીવનની ગુણવત્તામાં પણ અમૂક પરિવર્તન જરૂરી છે. જે જગ્યા વાતાવરણ કે લોકો સાથે દાડુ પીવાનું સંકળાયેલ છે એ તમામને આયોજનપૂર્વક તમારી ઇટિન જિંદગીથી દૂર કરવા ખૂબ જરૂરી છે. દાડુ સાથે સંકળાયેલા વિચારોને પણ મનમાંથી દૂર કરી નાખો. રોજની અવરજનવરનો રસ્તો પણ જરૂર લાગે તો બદલી નાખો. જૂના દારૂદિયા ‘મિત્રોને’ (ખરેખર શત્રુઓને?) મળવાનું પણ ટાળો અને જ્યાં દાડુ પીરસાતો હોય એવી પાર્ટીમાં જવાનું બંધ રાખો.

**(અ) ખાવાનો સમય નિયમિત કરી દો:** ભૂખ્યા રહેવાથી (ખાલી પેટે) દાડુ પીવાની તલપ વધુ તીવ્ર બને છે. નિયમિતપણે સમયે સમયે ખાતાં રહેવાથી દારૂની તલપ ઓછી રહે છે. વળી પૌષ્ટિક ખોરાકની આમ પણ દારૂના વ્યસનીઓને ખાસ જરૂર હોય છે. વધુ પ્રોટીન અને વધુ વિટામિન મળે એ માટે દૂધ અને કઠોળનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરો. જ્યારે ખૂબ કામના બોજા ડેઠળ હો ત્યારે તો ખાસ યાદ રાખીને સમયસર જમી લેવું જોઈએ, નહીં તો આવા પ્રસંગે જ માનસિક તાણ ડેઠળ ફરીથી દાડુ શરૂ થઈ જતો હોય છે.

**(બ) કાયમ લોકોની વચ્ચે જ રહો - એકલતા ટાળો:** એકલતા દારૂના વ્યસનને વકરાવે છે. દાડુ છોડવા માટે મહેનત કરનાર વ્યક્તિએ એકલા રહેવાનું પ્રયત્નપૂર્વક ટાળવું જોઈએ. કુટુંબીજનો કે નીર્વસની મિત્રોના સાનિધ્યમાં રહેવાથી

વ्यसन યાદ નથી આવતું. તમારા ગુરુ કે માર્ગદર્શકને પણ વારંવાર મળતા રહો અને અજાણ્યા લોકો સાથે પણ હળવા મળવાનું વધારો.

**(ક) સક્રિય બનો:** દારુ છોડવાથી દારુ અને નશા પાછળ બરબાદ થતો સમય બચે છે જેના સદ્ગુપ્ત્યોગનું પૂર્વ આયોજન કરી રાખો. નિરંતર કાર્યરત રહેનાર વ્યક્તિને જલદી વ્યસનની યાદ નથી સત્તાવતી. ફુરસદના સમયમાં ખુલ્લા વાતાવરણમાં ચાલવાનું; બાળકો સાથે બાળમાંફરવાનું; યોગાસન કરવાનું; એરોબીક કસરત કરવાનું; સંગીત સાંભળવાનું કે અન્ય કોઈ પણ મનપસંદ નિર્વસની કામ કરવાનું ગોઠવી શકાય. અન્ય દારુ પીનારાઓને દારુ છોડવવાનું કામ કે જરૂરિયાતવાળી વ્યક્તિને યથાશક્તિ મદદ કરવાનું કામ પણ કરી શકાય.

**(દ) દારુ છોડનારાના જૂથમાં ભળો (આલોહોલિક એનોનિમસ):**

દારુ છોડનારાઓ પોતાના અનુભવ પરથી અન્ય લોકોને દારુ છોડવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. આલોહોલિક એનોનિમસ નામનું જૂથ આવા ભૂતપુર્વ અને વર્તમાન વ્યસનીઓનું બનેલું હોય છે. જે એક બીજાના અનુભવ અને ટેકાથી દારુ છોડી શકે છે. જૂથમાં વ્યક્તિ પોતાની તકલીફી, લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરી શકે છે અને અન્ય લોકોનું માર્ગદર્શન તથા હુંફ્ફ મેળવી શકે છે. પોતાના જેવી જ તકલીફ ધરાવતા અન્ય લોકોને મળીને વ્યક્તિની એકલતા અને નિરાશાની લાગણી દૂર થાય છે. વળી વ્યસન છોડનાર વ્યક્તિમાં દારુ ફરી શરૂ થઈ શકે એવા વિચારો, લાગણી કે વર્તન આ જૂથના ધ્યાનમાં જલદીથી આવી જાય છે જે વ્યક્તિને વધુ તકેદારી રાખવાની તાકીદ કરી શકે છે. દારુ પીનારા પુરુષોની પત્નીઓ માટે પણ વિશ્વભરમાં “અલ-અનોન” તરીકે ઓળખાતું જૂથ ચાલે છે. આ જૂથમાં જોડનાર દરેક વ્યક્તિની ઓળખ છૂપી રહે છે અને કોઈને પણ પોતાનું નામ જણાવવાની કે નોંધાવવાની જરૂર હોતી નથી.

**(૭) મન પર અસર કરતી અને ઊંઘની દવાઓથી દૂર રહો:** શક્રય હોય ત્યાં સુધી ડેક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ પ્રકારની માનસિક અસરો ધરાવતી દવાઓથી દૂર રહેવું જરૂરી છે. ડેક્ટરની દેખરેખ હેઠળ લેવાતી દવાઓ સિવાયની બીજી કોઈ પણ માનસિક અસરો કરતી દવાનું વ્યસન થઈ જવાની શક્યતા દારુના વ્યસનીઓમાં વિશેષ હોય છે. ઊંઘ ન આવવી કે ખરાબ સ્વખ આવવાં વગેરે તકલીફી માટે જાતે દવા લેવાની જરૂર નથી. કસરત, યોગાસન અને ઊંડા શાસોશ્વાસની પ્રક્રિયા મનને શાંત કરવા તથા ઊંઘ લાવવા માટે ઉપયોગી છે.

(C) દારુની 'ના' પાડતાં શીખો: કોઈ ગમે એટલો આગ્રહ કરે પરંતુ એને વિવેકપૂર્વક અને દફ્તાપૂર્વક 'ના' પાડતાં શીખવું ખૂબ જરૂરી છે. દારુની 'ના' હંમેશ દફ અને સ્પષ્ટ શબ્દોમાં પાડો. આગ્રહ કરનાર વ્યક્તિની આંખમાં આંખ મેળવીને વાત કરો. 'ના' પાડવાથી તમે કોઈની લાગણી નથી દૂભાવતા અને લાગણી દૂભાવતા હો તો પણ એ લાગણી તમારા ભલા માટેની નથી જ એની ખાતરી રાખજો. ઘણી વખત તો કોણે શું પીધું એની કોઈને દરકાર જ નથી હોતી. તમે દારુને બદલે જ્યુસ કે સોડા જેવું કંઈક પી શકો. 'દોસ્તી માટે એક પેગ' પીવાની ઓફર કરનારને એટલું જ કહેવું કે 'જો તું મારો દોસ્ત હોય તો મને મારા દુશ્મન જેવા દારુનો આગ્રહ ન કર'. દારુન પીવા માટે બહાનાં ન કઢો (આજે તબીયત નથી સારી વગેરે) પણ સ્પષ્ટપણે તમે કદ્દી નથી પીવાના એ નિર્ણય જાહેર કરો.

આમ, દારુ છોડવાનું અને છોડયા પછી ફરી કદી ન પીવાનું મહાબગીરથ કામ સફળ બનાવવું હોય તો એ માટે માનસિક તૈયારી અને પૂર્વઆયોજન ખૂબ જરૂરી છે. દારુ છોડવા ઈચ્છનાર દરેક દારુનીયાએ સંપૂર્ણ દાકતરી તપાસ કરાવ્યા પછી ડોક્ટરની સલાહ મુજબ આરામ કરવો જોઈએ. સંતુલિત ખોરાક અને બી-કોમ્પ્લેક્સ જૂથની દવાઓ તથા ડોક્ટરની સલાહ મુજબની દવાઓ લેવાથી દારુ છોડવામાં સરળતા રહે છે. દફ મનોબળ અને બુદ્ધિપૂર્વકના આયોજનથી વસનની ચુંગાલમાંથી છૂટી શકાય છે.

### વ્યાસનને 'ના' કહેવાની હિંમત કેળવો



## એક વખત દારુ છોડયા પછી ફરીથી એ વ્યસન શરૂ થવાની પ્રક્રિયા

દારુના વ્યસનીઓ દારુ છોડયા પછી ફરી ગમે ત્યારે દારુના વ્યસનમાં 'લપસી' પરવાની શક્યતા રહેલી છે. દારુ છોડયા પછી ફરીથી દારુ શરૂ થવાની પ્રક્રિયામાં માણસના મનની લાલચ ભાગ ભજવે છે. આ પ્રક્રિયા દરમ્યાન માણસના વિચાર, વર્તન અને લાગણીઓમાં નીચે મુજબનાં પરિવર્તનો જોવા મળે છે.

### ૧) વિચારોમાં પરિવર્તન

- જીવન પ્રત્યે નકારાત્મક અભિગમ
- વ્યસનમુક્ત રહેવા પ્રત્યે લાપરવાહી
- ઘણા વખતથી મેં દારુ નથી પીધો. હવે એકાદ વખત તો દારુ મળવો જ જોઈએ
- મારો વધુ પડતો દારુ પીવાનો પ્રશ્ન તો હલ થઈ ગયો છે હવે ક્યારેક ક્યારેક દારુ પીવામાં શું વાંધો?
- દારુ છોડવાની દવા હું ગમે ત્યારે ફરીથી પણ સફળતાપૂર્વક વાપરી શકીશ.

### ૨) લાગણીમાં પરિવર્તન

- વધુ પડતો લાગણીનો ઉછાળ
- હતાશા અને ચિંતા
- ગુર્સો અને નકામાપણાની લાગણી
- કંટાળો અને એકલતા
- જાત પ્રત્યે દયાની લાગણી

### ૩) વર્તણુંકમાં પરિવર્તન

- અન્ય લોકો સાથે વધુ પડતી દલીલબાજુ અને અધીરાપણું.
- દારુ છોડવા માટેની ખાસ દવા લેવાનું વારંવાર ભૂલાઈ જું.
- દારુ છોડેલા મિત્રોના જૂથની મીટિંગથી અણગા રહેવું.
- દારુની દુકાન આગળ મિત્રોને મળવાના બહાનાથી ઊભા રહેવું અને સોડા કે સોફ્ટ-દ્રિન્ક્સ પીવા.
- વધુ પડતી સિંગરેટ પીવી.
- દારુ સાથે સંકળાયેલ આનંદને વારંવાર યાદ કરીને એની ચર્ચા કરવી.
- દારુ પીવાનું શરૂ કરી દેવાની ધમકી આપવી.
- વધુ પડતો અવિચારી ખર્ચ કરવો.
- વધુ પડતો આત્મવિશ્વાસ દાખવવો અને સારા હોવાનો દેખાવ કરવો.

જો આ વિચારો-લાગણી અને વર્તણુંકને ઓળખીને સમયસર ચેતી જવામાં આવે તો ફરીથી વ્યસન શરૂ થતું અટકી શકે છે.

### ૩. કેફીન (ચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ)



કેફીન એ કદાચ વિશ્વમાં સૌથી વ્યાપક વપરાતો કેફી પદાર્થ છે. ચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ વગેરેમાં કેફીન અને થીયોષ્ટ્રોમીન નામના ઉત્તેજક પદાર્થ હોય છે જે શરીરના અનેક તંત્ર ઉપર જાત જાતની અસર કરી શકે છે.

**કેફીનની મગજ, ચિંતા, વિચાર અને ઊધ પર અસર:** મગજને ઉત્તેજિત અને સંકિય કરવાનું; વિચારો જડપી બનાવવાનું; કંટાળા અને થાકનો અનુભવ ઘટાડવાનું કે એને મોડો કરવાનું કામ આ પદાર્થ કરે છે. મગજને ઉત્તેજિત કરવા ઉપરાંત, હદ્યના ધબકારા વધારવાનું, હાથ-પગમાં પ્રુઝારી કરવાનું, વધુ પેશાબ બનાવવાનું, ઊધ ઊડાડી દેવાનું, એસિડિટિ, ગાઉટ, પથરી વગેરે રોગો વધારી દેવાનું કામ પણ આ તત્ત્વો કરી શકે છે. બાળકોમાં વર્તણુંક-સંબંધિત તકલીફો અને બીમારી કરવા માટે કોલા જેવાં પીણાં જવાબદાર જણાયાં છે. ચિંતાતૂર સ્વભાવ અને વર્તણુંક પણ ઘણી વખત કેફીનને આભારી હોય છે. કાયમ ચિંતામાં ખોવાયેલા લોકો ઉપરના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે માત્ર કેફીનો વપરાશ બંધ કરવાથી ઘણા લોકોની ચિંતા ઘટી જાય છે. ચિંતાતૂર વ્યક્તિની કામ કરવાની ક્ષમતા ચા-કોફીના સેવનથી ઓર ઘટી જાય છે. વૃદ્ધોની ઊધ ઊડાડી દેવાનું કામ કેફીન કરે છે. ઊધ મોરી આવે; ઊધનો કુલ સમય ઘટે અને ઊધમાંથી વારંવાર ઉછ્વું પડે એવું કેફીનના સેવનથી થાય છે. યુવાનોમાં આ અસર ઓછી જોવા મળે છે પરંતુ ઉમરની સાથે કેફીનની અસર વધતી જાય છે.

**કેફીનની બ્લાડપ્રેશર પર અસર:** ઘણા બધા અભ્યાસો જણાવે છે કે ચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ વગેરેમાં આવતા આ પદાર્થના વપરાશથી ઉપરનું (સિસ્ટોલિક) બ્લાડપ્રેશર પ થી ૧૫ મિ.મિ. મકર્યુરી જેટલું અને નીચેનું (ડાયાસ્ટોલિક) બ્લાડપ્રેશર પ થી ૧૦ મિ.મિ. મકર્યુરી જેટલું વધે છે. એક વખત કેફીન શરીરમાં જાય પછી

અડ્વાથી એક કલાકમાં એની મહત્તમ અસર દેખાય છે અને પછી પાંચ કલાકમાં આ અસર અડ્વી થઈ જાય છે. જો વસ્તીનો દરેક સભ્ય કેશીનનું સેવન છોડી દે તો આખી વસ્તીના સરેરાશ બ્લડપ્રેશરમાં ૨ થી ૪ મિ.મિ. મકર્યૂરી જેટલો ઘટાડો થાય. અને સરેરાશ બ્લડપ્રેશરમાં થતો આટલો ઘટાડો, આશરે ૮ થી ૧૪% હૃદયરોગના હુમલા અને ૧૭ થી ૨૪% પેરાલિસિસના હુમલાને આવતા અટકાવી શકે. બ્લડ પ્રશર ઘટાડવાની બધી દવાઓના વપરાશ પછી પણ આટલો ઘટાડો શક્ય નથી જે માત્ર કેશીનનો વપરાશ બંધ કરવાથી થઈ શકે છે.!

**કેશીનની હૃદય પર અસર:** કેશીનના સેવનથી હૃદયના ધબકારા બધી જાય છે અને હૃદયમાંથી વધુ લોહિતું પંપીગ થાય છે. ટૂંકમાં કેશીનનું પીણાં હૃદયની કામગીરી વધારી દે છે. આ ઉપરાંત, કોશીમાં રહેલ કાફેસ્ટોલ અને કાણ્ણવીઓલ નામનાં દ્વયો લિવર પર વિપરીત અસર કરે છે અને પરિણામે કોલેસ્ટેરોલના ચયાપચયમાં વિક્ષેપ આવે છે. ટિવસમાં પાંચ થી ૧૫ ટકા ડાળેલી કોશી પીનાર વ્યક્તિના શરીરમાં નુકસાનાકારક (એલ.ડી.એલ.) કોલેસ્ટેરોલનું પ્રમાણ ૮ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં નુકસાનાકારક (એલ.ડી.એલ.) કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦ ટકા જેટલું વધે તો અને હૃદયરોગ થવાની શક્યતામાં ૨૦ ટકા જેટલો વધારો થાય છે. (જો પેપર ફિલ્ટર વાપરીને કોશી બનાવવામાં આવે તો આ કોલેસ્ટેરોલ વધવાની અસર અટકાવી શક્ય છે પણ ફિલ્ટરથી કેશીન ઘટતું નથી.)

**કેશીનની હાડકાં પર અસર:** રજોનિવૃત્તિ પછી ચા-કોશીનું સેવન કરવાથી હાડકાં નબળાં પડવાની તકલીફ (ઓસ્ટિયોપોરોસિસ) થાય છે. આખી જિંદગી દરમ્યાન શરીરમાં ગયેલ કુલ કોશી (અને અન્ય કેશીનનું પદાર્થ)નું પ્રમાણ હાડકાં નબળાં પડવાની તીવ્રતા નક્કી કરે છે.

**ચા-કોશી-કોલા ડ્રિન્ક્સ અને એસિડિટિ:** ચા, કોશી અને કોલા રીન્ડસનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવાની પ્રવૃત્તિ ઝડપી બને છે. જેમ વધુ કદક ચા-કોશી હોય તેમ એસિડિટિ થવાની શક્યતા વધુ રહે છે. કેશીન કાઢી નાંખેલ (ડિ-કેશીનેટેડ) કોશીથી પણ આવી અસર થાય છે. કોલા ડ્રિન્ક પોતે જ ખૂબ એસિડિક હોય છે અને કાર્બોનેટેડ હોવાથી એસિડિટિ કરવાની શક્યતા વધારી દે છે.

**સગર્ભાવસ્થા દરમ્યાન કેશીનના સેવનની અસરો:** સગર્ભાવસ્થા દરમ્યાન જો કેશીનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આવનાર બાળક ખોડખાંપડા ધરાવતું આવી શકે છે. રોજના પાંચ કપથી વધુ કોશી પીનાર સગર્ભ સ્રીને કસુવાવડ થવાની, અધૂરા માસે બાળક જન્મવાની, અને ઓછા વજનવાળું બાળક આવવાની શક્યતા વધી જાય છે. માત્ર કોશી જ નહી પરંતુ કેશીન ધરાવતા દરેક પદાર્થ (દા.ત. ચોકલેટ કે કોલા ડ્રિન્ક્સ) સગર્ભાવસ્થા દરમ્યાન લેવાથી બાળકને નુકસાન થઈ શકે છે.

**સ્તનપાન દરમ્યાન કેફીનનું સેવન બાળકમાં એલજર્ કરી શકે:** જો સ્તનપાન કરાવતી માતા કોકો પાવડર કે ચોકલેટ ખાય તો એના દૂધ વાટે બાળકના શરીરમાં પણ થીયોબ્રોમીન જઈ શકે છે જેને કારણે બાળકમાં એલજર્ લક્ષણો આવી શકે છે. કોકો પાવડર અને ચોકલેટમાં હિસ્ટામ્બીન અને ટાઇરેમાઈન નામના તત્વો હોય છે જે અમૃક સંવેદનશીલ વ્યક્તિત્વોમાં એલજર્ કરી શકે. આ ઉપરાંત ઘાવણા બાળકની ઉઘ ઊડાડી નાંખવા માટે અને ચીડિયાપણા માટે માતા દ્વારા કેફીનનું વધુ પડતું સેવન જવાબદાર હોય છે.

**કેફીનના સેવનથી કેન્સર થઈ શકે?** કોકી અને કેફીનના વધુ પડતા સેવનથી મૂગાશયનું કેન્સર થઈ શકે એવા પ્રાથમિક રિપોર્ટ છેલ્લા થોડા વખતથી મળી રહ્યા છે. કેફીનથી કેન્સર થવાની શંકા ઘણાં વૈજ્ઞાનિકોને છે જે હજુ વધુ અભ્યાસોથી પાડી થઈ શકશે.

**કેફીન ધરાવતાં પીણાં અને ખાદ્ય પદાર્થો:** સાથેનાં કોષ્ટકમાં દર સો ગ્રામ ખાદ્ય પદાર્થમાં રહેલ કેફીન અને થીયોબ્રોમીનનું સરેરાશ પ્રમાણ જણાવેલ છે. આ કોષ્ટકમાં અખ્યાત જોઈ શકાય છે કે, તૈયાર કોકીમાં દર સો ગ્રામે પચાસ મિ.ગ્રા. કેફીન આવે છે અને કોલા સોફ્ટ ડ્રિન્ક્સમાં એ પ્રમાણ સો ગ્રામે દશ મિ.ગ્રા. જેટલું હોય છે. ઘણા લોકો નાના બાળકોને ચા-કોકી નથી આપતા પણ એટલું જ નુકસાન કરતાં ચોકલેટ અને કોલા સોફ્ટડ્રિન્ક્સ છૂટથી લેવા દે છે! કોલા ડ્રિન્ક્સમાં રહેલ કેફીન ચા-કોકીના કેફીન જેવી જ આડઅસરો કરે છે. ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૮૦ ની સાલ વચ્ચે દુનિયામાં કોકીના વપરાશમાં ૩૬% નો ઘટાડો નોંધાયો હતો પણ એ જ ગાળા દરમ્યાન કેફીનયુક્ત સોફ્ટ ડ્રિન્ક્સના વપરાશમાં ૨૩% ટકા જેટલો ભારે વધારો નોંધાયો! આ જ રીતે કેફીનયુક્ત ચોકલેટનું ચલાણ પણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે.

**દર સો ગ્રામ ખાદ્ય પદાર્થમાં રહેલ કેફીન અને થીયોબ્રોમીનનું સરેરાશ પ્રમાણ**

ખાદ્ય પદાર્થ (સો ગ્રામ)	કેફીન (મિ.ગ્રા.)	થીયોબ્રોમીન (મિ.ગ્રા.)
કોકી પાવડર	૩,૧૪૨	-
કોકી પાવડર, ચીકોરી સાથે	૨,૦૬૩	-
ચા ભૂકી	૪,૩૫૨	૨૬૩
કોકો પાવડર	૨૩૦	૨,૦૫૭
તૈયાર કોકી	૫૦	-
એક્ષપ્રેસો કોકી	૨૧૨	-
તૈયાર ચા	૨૦	૨
કોલા સોફ્ટ-ડ્રિન્ક્સ	૧૦	-
ડ્રિકિંગ ચોકલેટ	૨	૨૩
મિલ્ક ચોકલેટ બાર	૨૫	૧૦૦


કોડો પાવડરમાં ૨૫ ટકા ચરબી હોય છે. સો ગ્રામ કોડો પાવડરમાંથી ૫૦૦ ડિ.કેલરી શક્તિ મળે છે. સાદી ચોકલેટમાં દર સો ગ્રામે ૫૪૫ ડિ.કેલરી તથા મીલ્ડ ચોકલેટમાં દર સો ગ્રામે ૫૮૦ ડિ.કેલરી હોય છે. રોજે રોજ ચોકલેટ બાર ખાવાના વસનીઓ ચોકલેટ સાથે ઘણી બધી ચરબી અને કેલરી પેટમાં પથરાવે છે.

### કેફીનનું વ્યસન છોડવા શું કરતુ?

આ - કેફીનનું વ્યસન છોડવા માટે કોઈ મોટા પ્રયત્ન કરવા નથી પડતા. સામાન્ય રીતે, માત્ર દઢ નિષ્ઠ્ય અને માથાનો સામાન્ય દુખાવો સહન કરવાની તૈયારી હોય તો આપમેળે જ વ્યક્તિ વ્યસનમુક્ત થઈ શકે છે.

★ ★ \*

## ૪. અફીણ, હેરોઇન અને બ્રાઉન સુગર



કોઈ પણ જાતના દુખાવામાં નોંધપાત્ર ઘટાડો કરે, થોડુંક ધેન લાવે, ઉધરસ અને જાડાનાં લક્ષણો દબાવી હે અને એક પ્રકારની ‘બધું સારું ચાલી રહ્યું છે’ ની (સારાપણાંની) લાગણી ઊભી કરે એવી અદ્ભુત શક્તિ અદ્ભુત અદ્ભુત અને એના જેવી દવાઓમાં રહેલી છે. અદ્ભુતમાંથી અનેક તખીબી દવાઓ બને છે એ ઉપરાંત અનેક નશીલી દવાઓ પણ એમાંથી બને છે. હેરોઇન અને બ્રાઉન સુગર આવી અદ્ભુત જેવા ગુણર્થમં ધરાવતી નશીલી દવાઓ છે. હેરોઇન એ સફેદ પાવડર સ્વરૂપે હોય છે અને ખૂબ મૌંઘો હોય છે. આ પાવડરમાં અન્ય પદાર્થ (દા.ત. ચુનો, રાખ કે કોઈપણ નકામી વસ્તુ) બેળવીને મળતો સર્તો પાવડર બ્રાઉન સુગર તરીકે વેચવામાં આવે છે. અદ્ભુત માત્ર મૌં વાટે લઈ શકાય છે જ્યારે હેરોઇન નસમાં ઇન્જેક્શન વાટે અને બ્રાઉન સુગર ધૂમાડા સ્વરૂપે લેવામાં આવે છે.

અફીણાનાં મન બહેલાવવાના અને દર્દ દૂર કરવાનાં લક્ષ્યાને કારણો એ લેવાની લાલચ થાય છે, એટલું જ નહીં દેશી અને ઘરગથ્થું દવાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. એક વાર લીધા પછી મગજની અંદર એવાં પરિવર્તનો કરે છે કે જેથી શરીર અને મન વારંવાર એની માંગ કર્યા કરે અને એ ન મળે તો શારીરિક અને માનસિક તકલીફો ઊભી થાય. અફીણાનું બંધાણ ખૂબ જ ભારે હોય છે અને માણસને માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક રીતે પાયમાલ કરી નાંબે છે.

અફીણાનું બંધાણ શરૂ થવામાં સોબત અને સામાજિક રીતરિવાજ જવાબદાર હોય છે. ઘણી જગ્યાએ બાળકો રડીને મા-બાપને હેરાન ન કરે એ માટે નાની ઉમરે બાળક ઘોડિયામાં હોય ત્યારથી રોજ થોડુંક અફીણ આપવામાં આવે છે! ક્યારેક કોઈક બીમારી કે પેટના દુખાવા માટે પણ અફીણ આપવામાં આવે છે. દરેક લગ્ન કે મરણ પ્રસંગે ફરજિયાત અફીણ લેવાની પ્રથા કેટલાંક સમાજમાં જોવા મળે છે.

લાંબા ગાળાના અફીણાના વપરાશને કારણો શરીરના ચેતાતંત્ર, પાચનતંત્ર અને શ્વસનતંત્ર પર આડ અસરો થાય છે. બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો થવો, કાયમી કબજિયાત રહેવી, ખૂબ મરી જવી, શ્વસનતંત્રમાં વારંવાર ચેપ લાગવો, જીતીય જીવનમાંથી રસ ઉડી જવો વગેરે તકલીફો લાંબે ગાળે જોવા મળે છે.

જો એક સાથે વધુ પ્રમાણમાં અફીણ લઈ લેવામાં આવે તો, શાસોશ્વાસનો દર એકદમ ઘટી જાય છે અને હદયના ધબકારા પણ ઘટી જાય છે. આંખની કીકી એકદમ ઝીણી થઈ જાય છે, શરીરનું તાપમાન ઘટવા લાગે છે અને દર્દી બેહોશ થઈ જાય છે. જો તાત્કાલિક સારવાર ન મળે તો શરીર ખૂબું પડી જાય અને પછી મૃત્યુ થાય છે.

અફીણાનાં બંધાણીઓને જો સમયસર અફીણ ન મળે તો, જાડા થઈ જાય, ઊબડા આવે, ખાંસી આવે, આંખમાંથી પાણી નીકળે, નાક ગળે, ખૂબ પરસેવો થાય, હાથ-પગના સ્નાયુ ખેંચાય, તાવ જેવું લાગે, શાસોશ્વાસનો દર વધી જાય, આખા શરીરમાં કળતર થાય, ખૂબ બગાસાં આવે, ઊંઘ ન આવે અને અફીણ માટે તીવ્ર તલપ લાગે. આ બધાં લક્ષ્યાની શરૂઆત છિલ્યું અફીણ લીધાના આઠ થી સોણ કલાક પછી થાય છે, જેની તીવ્રતા ઉદ્દીપન કરી આપાસ વધી જાય છે અને પાંચ થી આઠ દિવસ સુધી આવી વિશેષ તકલીફો થયા પછી ધીમે ધીમે બધી તકલીફ જતી રહે છે.

જો પાંચ થી સાત દિવસ સુધી યોગ્ય દવાઓ આપીને આ તકલીફને કાબૂમાં રાખવામાં આવે તો સહેલાઈથી અફીણ છોડાવી શકાય છે. કેટલાક લોકોમાં છ મહિના સુધી થોડી થોડી તકલીફ રહ્યા કરે અને એ દરમ્યાનમાં જો અફીણ મળી જાય તો ફરી પાછા એના વ્યસની બની જાય છે. ભણશાળી ટ્રસ્ટ દ્વારા છિલ્યાં દશથી પણ વધુ વર્ષોથી બનાસકાંઠામાં ચાલતા અફીણ-મુક્તિ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં દશ હજારથી પણ વધુ બંધાણીઓને સકળતાપૂર્વક અફીણ છોડાવી શકાયું છે. અલબત્ત, સામાજિક રિવાજ, ચુંટણી અને લાલચને લીધે આશરે પચ્ચીસ ટકા બંધાણીઓમાં ફરીથી વ્યસન શરૂ થઈ જાય છે. જો અફીણ મળવાનું બંધ થાય તો, આ વ્યસન સંપૂર્ણ નાબૂદ કરી શકાય.

## ૫. ચરસ-ગાંજો અને ભાંગ

કેનાબીસ ઈન્ડિકા નામે ઓળખાતા ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો અને ભાંગ જેવા નશીલા પદાર્થો મળે છે. આ છોડમાંથી મળતું રસાયણ આમ તો બિન-નશાકારાક હોય છે. પરતું એની પર પ્રકાશ પડવાથી ટેટ્રાહાલેનાબીનોલ નામનો નશીલો પદાર્થ બને છે. આ વનસ્પતિનાં સૂક્ષ્માં પાન અને અંકુરને ઉકાળીને ભાંગ બનાવવામાં આવે છે.



ભાંગમાં લગભગ ૧૫ ટકા જેટલું નશીલું દ્રવ્ય હોય છે. તાજુ બનાવેલ ભાંગ વધુ નશો કરાવે છે. ભાંગ નાંખીને બનાવેલ મિઠાઈને મજૂન કહેવાય છે જે લૂભ અને જાતીયવૃત્તિ ઉત્સેજવા માટે વપરાય છે.

કેનાબીસ ઈન્ડિકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં ૧૫ થી ૨૫ ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે છોડની ડાળી અને પાનમાંથી 'રેઝિન્સ' બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં ૩૫ થી ૪૦ ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે જ થાય છે. હુક્કા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધૂમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે.

મોં વાટે ભાંગ કે મજૂન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ગ્રાશ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો

લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે. નશાની અસરમાં સમયનું ભાન બિલકુલ જતું રહે છે. સપાર-સાંજનું કે સમય પસાર થઈ રહ્યાનું ધ્યાનમાં આપતું નથી. ટૂટા-ગાળાની યાદશક્તિ ઘટી જાય છે - વાક્ય પૂરું બોલાઈ રહે ત્યાં સુધીમાં વાક્યની શરૂઆત ભૂલી જવાય છે. એકાગ્રતા ઘટી જાય છે. વાહન ચલાવવાની ક્ષમતામાં ઘટાડો થાય.

ચરસ-ગાંઝો કે બાંગ લેવાથી આંખ લાલ થઈ જાય છે, અને હદ્યના ધબડારા વધી જાય છે. હદ્યરોગના દર્દીમાં એજાઈનાનો કે હદ્યરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંઝો જવાબદાર બની રહે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફણો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉત્તરી જાય છે.

ક્યારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુઃખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંઝનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, શ્રુજારી, પરસેવો, ઊંબડા, ઊલટી, જાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારુ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઈ દવા કે સારવારની મોટે ભાગો જરૂર પડતી નથી. દઢ મનોબળથી નિશ્ચય કરીને કાયમ માટે આ વ્યસન છોડી શકાય છે.

## ૬. કોકેઇન

કોકા વનસ્પતિના પાનમાંથી કોકેઇન મળે છે. આ ઉત્તેજક પદાર્થ છે. ચામડી પર લગાવવામાં આવે તો એ ભાગની સંવેદના અને રક્તપ્રવાહ ઘટાડી હે છે. જ્યારે મોં વાટે ખાવાથી, નાક વાટે સુંઘવાથી, નસ વાટે ઈન્જેક્શનથી કે ધૂમ્રપાન સ્વરૂપે હુંકવાથી એ શરીરની અંદર પ્રવેશે ત્યારે માણસના મન અને વર્તન ઉપર ગાઢ અસર કરે છે. સામાન્ય રીતે કોકેઇનના વ્યસનની શરૂઆત નાક વાટે છીકણીની જેમ એનો પાવડર સુંઘવાથી થાય છે. નાકથી સુંધા પછી ગ્રાસ થી પાંચ મિનિટની અંદર કોકેઇનની અસર શરૂ થઈ જાય છે; દશ-બાર મિનિટમાં તો એની સર્વોચ્ચ અસર દેખાય છે અને અદ્ધાથી એક કલાક પછી બધી અસર ખતમ થઈ જાય છે.

કોકા-પેસ્ટ અથવા કોકેઇન-ફી બેઝનો ઉપયોગ ધૂમ્રપાનથી કોકેઇન લેવા માટે થાય છે. ધૂમ્રપાન દ્વારા કે નસમાં ઈન્જેક્શન દ્વારા જ્યારે કોકેઇન લેવામાં આવે ત્યારે ગણતરીની સેંકડોમાં (૮ થી ૧૦ સેંકડમાં) એની અસર શરૂ થઈ જાય છે અને કલાકેકમાં અસર પૂરી થઈ જાય છે.

કોકેઇનને કારણે મનમાં ઉતેજના આવે “મૂડ” ખીલે છે, અને “બધું સારું લાગે છે”. સાથે સાથે બ્લડપ્રેશર, હદ્યના ધબડારા અને શરીરનું તાપમાન પણ થોડુંક વધે છે.

જો તોઝ વધી જાય તો વધુ બ્લડપ્રેશર કે વધુ પડતા તાવને કારણે કોકેઈનના બંધાણીનું મૃત્યુ થાય છે. કોકેઈન લેવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જવાને લીધે કે ખેચ આવવાને કારણે મૃત્યુ થયાના ડિસાઓ પણ નોંધાયા છે. લિવર અને ફેફસાંને કાયમી નુકસાન કરવા માટે કોકા-પેસ્ટનું ધૂમ્રપાન જવાબદાર જણાયું છે. લાંબા સમય સુધી કોકેઈનનું સેવન કરનાર વ્યક્તિ ગાંડા જેવો થઈ જાય છે - બીજા લોકો પોતાને નુકસાન કરશે એવા વિચારો આવે અને ન હોય ત્યાં અવાજ સંભળાવા કે કશું ન હોય તો પણ કંઈક દેખાયાનો ભ્રમ એવી વ્યક્તિને થયા કરે છે. કોકેઈન લીધા પછી તરત જાતીયવૃત્તિઓ ઉશ્કેરાય છે પરંતુ એના લાંબા ગાળાના વપરાશથી સામાજિક અને જાતીય જીવનમાંથી રસ ઉડી જાય છે. પુરુષમાં નપુંસકતા અને સ્તરન મોટા થવાની તકલીફ તથા સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા અને વંધ્યત્વ કોકેઈનના સેવનથી થઈ શકે છે. સગર્ભાવસ્થા દરમ્યાન કોકેઈનનું સેવન કરવાથી ખોડખાંપણવાનું બાળક આવે છે.

કોકેઈન છોડાવવા માટે મનોચિકિત્સક, ફેમીલી ફીજીશ્યન અને મનોસામાજિક કાર્યકરની જરૂર પડે છે. કોકેઈન લીધા પછી એને બંધ કરવા ઈચ્છનાર વ્યક્તિને હતાશા, ગુનાદીત લાગણીઓ, અનિદ્રા, ભૂખ મરી જવી વગેરે તકલીફો થાય છે. સાઈકોથેરપી, ગૃહથેરપી, અને સામાજિક ટેકો દરેક વ્યસની માટે ખૂબ જરૂરી છે. જરૂર પડ્યે ડૉક્ટર ડેસ્પ્રાભીન જેવી ડિપ્રેશનમાં વપરાતી દવા કોકેઈન છોડાવવા માટે આપતા હોય છે. જો કોકેઈનનો વધુ પડતો તોઝ લેવાથી કોઈ તકલીફ થાય તો તાત્કાલિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે અને એનું જીવન બચાવવા માટે ઇન્ટેન્સિવ-કેર યુનિટમાં યોગ્ય સારવાર આપવી પડે છે.

## ૭. એલ. એસ. ડી


લાઈસર્જક એસિડ ડાય-ઇથાઇલેમાઈડ (એલ.એસ.ડી.) તરીકે ઓળખાતો આ નશીલો પદાર્થ બેશુદ્ધ માટેની દવા શોધતાં શોધતાં આડસિમક જ એની નશાકારક અસર માટે મળી ગયો! માત્ર ૨૦ માઈકોગ્રામ જેટલો એલ.એસ.ડી. માનસિક અને શારીરિક અસરો કરવા સક્ષમ છે. એ ખાવાથી મનમાં ચિત્ર-વિચિત્ર વિચારો આવે કે દૃશ્યો દેખાય એવું બને છે. “મૂડ”માં ખૂબ મોટા ફેરફરો થાય અને જાતજાતની કલ્પનાઓમાં વ્યક્તિ વિહરવા લાગે છે. ચિત્ર-વિચિત્ર રંગો દેખાય અને સંગીત સંભળાય છે. આ ઉપરાંત, હૃદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશર વધી જાય, કીકી પહોળી થઈ જાય, ધૂજરી આવે અને તાવ આવે એવું બને છે.

મો વાટે એલ.એસ.ડી. લીધા પછી અડવો કલાકમાં અસર દેખાય છે, બે-ત્રાણ કલાકમાં મહત્તમ અસર દેખાય છે અને ૧૨ થી ૧૮ કલાક પછી અસરો નાબૂદ થાય છે. વારંવાર આ નશીલો પદાર્થ લેવાથી એની અસર ઘટવા લાગે છે અને નશો મેળવવા વધુ

ને વધુ ડેઝ વાપરવો પડે છે. આ દવા લાંબો સમય લીધા પણી અચાનક બંધ કરી નાંખવાથી કોઈ ખાસ આડઅસર થતી નથી.

ક્યારેક એલ.એસ.ડી. લેવાથી ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે. જાણો કંઈક ચોરી કરી હોય કે ગુનો કર્યો હોય અને જે પ્રાસ્કો પડે એવો અનુભવ કેટલાકને થાય છે. લાંબો સમય આ નશાળું સેવન કરનાર માનસિક સંતુલન ખોઈ બેસે છે, યાદશક્તિ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે. નિર્ણયક્ષમતા અને પ્રશ્નનો હલ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. નશો બંધ કર્યા પછી પણ ઘણીવાર ફરી પાછો નશીલી હાલતમાં થયેલ અનુભવ (ફ્લેશ બેક) થાય છે. વાંરવાર આવું થાય તો દર્દી ગાંડો થઈ જાય છે અને આપધાત પણ કરી બેસે છે. ગર્ભસ્થ બાળકને આ પદ્ધતિ નુકસાન પહોંચાડે છે.

આ નશો કોઈ જાતની દવા કે સારવાર વગર જાતે જ પ્રયત્ન કરીને સહેલાઈથી છોડી શકાય છે.



## વ्यसनो છોડવા માટેની બિહેવીયર થેરપી

માણસ પાસે ચોકક્સ જાણકારી હોવા છતાં, પોતાને નુકસાન કરે એવી વર્તણુક એ જલદી બદલી શકતો નથી. કઈ ટેવો કે વર્તણુક નુકસાનકારક છે એની જાણકારી મેળવવી ખૂબ આવશ્યક છે પરંતુ જો પોતાની ટેવો, વ્યસનો કે વર્તણુકની તરાહમાં પરિવર્તન લાવવું હોય તો માત્ર જાણકારી મેળવવાથી એ શક્ય નહીં બને. જાણકારીની સાથે સાથે જરૂરી છે - દફ નિશ્ચય!

માણસની વર્તણુક બદલવા માટેની મથામણને “બિહેવીયર થેરપી” (વર્તણુક ઉપચાર પદ્ધતિ) તરીકે ઓળખવામાં આવે છે. બિહેવીયર થેરપી વર્ષાથી વ્યસનમુક્તિ માટે વપરાતી આવે છે. બિહેવીયર થેરપીમાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે જેની ઉપર તલસ્પર્શી અત્યાસ-વિચાર-સ્વાધ્યાય જરૂરી છે.

(૧) સ્વ-દેખરેખ : કોઈપણ વર્તણુક બદલવા માટે સૌથી પાયાની બાબત અત્યારની પોતાની વર્તણુકને ધ્યાનપૂર્વક, ઊડાણથી સમજવાની છે. ઘણી વખત ઊડાણપૂર્વક વિચારવાથી ‘કયારે?; ‘કેવી પરિસ્થિતિમાં?’ વધુ વ્યસનનું સેવન થાય છે એ સ્પષ્ટ બને છે. વ્યસન-સંબંધી વર્તણુકની સ્વ-દેખરેખ માટે, નીચેના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રીતસરની લેખિત નોંધ રાખવી જરૂરી છે -

★ વ્યસનનો સમય અને સ્થળ : રોજ કઈ જગ્યાએ, કેટલા વાગ્યે વ્યસનનું સેવન કર્યું એની નોંધ (લોગબુક) બનાવવી. ૧૦-૧૫ દિવસ પણી એનું વિશ્વેષણ કરવું.

★ વ્યસન લેતી વખતે અન્ય કોઈની હાજરી / કંપની હતી? કોઈ ચોકક્સ વ્યક્તિ કે સમૂહની હાજરીમાં વધારે વ્યસન થાય છે કે એકલા એનો અંદાજ આ નોંધ રાખવાથી આવી શકશે.

★ કેટલા પ્રમાણમાં વ્યસન? દરેક વખતે ચોકક્સ કેટલાં પ્રમાણમાં વ્યસન માટે જવાબદાર વસ્તુ લીધી એની નોંધ ખૂબ આવશ્યક છે. ઘણા લોકો થોડું થોડું કરીને ખૂબ વધુ પ્રમાણમાં વ્યસનકારક વસ્તુ લેતા હોય છે - જે અમના પોતાના પણ ધ્યાન બહાર હોય છે. ઘણી બધી વ્યક્તિઓ આખા દિવસની નોંધ વાંચીને બે-ત્રાણ દિવસમાં જ સમજ જાય છે કે પોતાની ધારણાં કરતાં પોતાનું વ્યસન કેટલું વધારે છે.

★ વ્યસન કરતી વખતે શું વિચાર કે લાગણી થયાં? દરેક વખતે વ્યસનકારક વસ્તુના સેવન સાથે સંકળાયેલ વિચારો અને લાગણીની પણ નોંધ રાખવી. ચિંતા, કંટાળો, ડિપ્રેશન, કામનું ભારણ વગેરે બધાં પરિબળોની નોંધ રાખવી. કઈ માનસિક પરિસ્થિતિમાં વધુ વ્યસન લેવાઈ જાય છે તે આ નોંધ ઉપરથી ખ્યાલ આવે છે.

★ વ્યસન ઉપરના નિયંત્રણનો અહેસાસ થાય છે? ઘણા લોકોને વ્યસનનાં નિયંત્રણો ખૂબ આકરાં અને અસંચ લાગતાં હોય છે જ્યારે અન્ય કેટલાક લોકોને ખાસ કશી તકલીફ નિયંત્રણથી લાગતી નથી. કઈ વખતે, કયા સંજોગોમાં વ્યસનનું નિયંત્રણ અસંચ લાગ્યું,

ક્યારે નિયંત્રણની ખબર જ ન પડી અને ક્યારે નિયંત્રણ ન રાખી શકાયું આ વિગતની રોજની નોંધ સ્વ-દેખરેખ માટે ખૂબ ઉપયોગી થાય છે.

(૨) ઉત્તેજના-નિયંત્રણ : વસનને ઉત્તેજન આપે એવી પરિસ્થિતિ - વ્યક્તિ કે વસ્તુથી દૂર રહેવાથી વસન ઉપર સારુ નિયંત્રણ આવી શકે છે.

(૩) હકારાત્મક અભિગમ અને વૈચારિક નવનિર્માણ : જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવનાર સફળતાપૂર્વક વર્તણુકમાં પરિવર્તન લાવી શકે છે. વૈચારિક સ્પષ્ટતા અને નાની નાની વાતોમાં લાગણીશીલ ન થઈ જવાની ટેવ કેળવવાથી સ્વસ્થ ચિત્તે ઘટનાઓ, બીમારી અને આરોગ્ય જળવણીની વાસ્તવિકતા નજર સમક્ષ આવશે. નિરાશાવાદી વ્યક્તિઓ પોતાની આરોગ્ય જળવણી પ્રત્યે પણ બેદરકાર જ રહે છે અને વસન છોડવામાં સફળ નથી થઈ શકતા.

(૪) તણાવ-મુક્તિ, કસરતો અને યોગાસન-ધ્યાન : સ્વસ્થ હકારાત્મક વિચારવાની રીત તણાવ-મુક્તિનું પહેલું પગથિયું છે. એની સાથોસાથ રોજની ૪૫ મિનિટની એરોબિક કસરત (આલવું, દોડવું, તરવું, સાઈકલીગ, દોરડાં કુદવાં વગેરે) અને ૧૫-૨૦ મિનિટ આસન-ધ્યાન શારીરિક અને માનસિક સ્ફૂર્તિ આપે છે, તણાવમાંથી મુક્તિ અપાવે છે. ધીમા ઊડા શાસોશ્વાસ અને શવાસન પણ તણાવ-મુક્તિ માટે ઉપયોગી છે. તણાવમુક્તિ એ વસનમુક્તિનો રાજમાર્ગ છે.

(૫) પ્રોત્સાહન : મિત્રો, વડીલો, ડોક્ટર વગેરે તરફથી સતત પ્રોત્સાહન મળતું રહે તો વસનમુક્તિમાં સફળતા મળે છે. માત્ર નિષ્ફળતા બદલ મહેણાં મારવાનું બંધ થાય તો પણ વ્યક્તિ ભવિષ્યમાં સફળતા મેળવી શકે છે. વ્યક્તિ પોતે પણ પોતાની સિદ્ધિ માટે વસન સિવાયના ઇનામરૂપ બદલાઓ (દા.ત. પિકચર, પિકનિક વગેરે) મેળવી શકે.

(૬) કટોકટી નિયંત્રણ : બધું કરવાં છતાં કોઈક નબળી ક્ષણો, વ્યક્તિ પોતાની જૂની કુટેવો શરૂ કરી દે છે. આવી ક્ષણોને સ્વ-દેખરેખથી ઓળખો એનાથી દૂર રહેવાના બધા પ્રયત્નો કરવા જોઈએ અને જ્યારે આવું થાય ત્યારે કઈ રીતે આ વર્તણુક કાબૂમાં લેવી એનો વિચાર પહેલેથી કરી રાખવો.

(૭) નિષ્ફળતામાંથી શિક્ષણ : કોઈપણ ટેવ પહેલા જ પ્રયત્ને છૂટતી નથી. માટે, બે-ત્રાણ વખત નિષ્ફળ પ્રયત્નથી ડરી ન જશો પરંતુ એમાંથી શીખીને ફરીથી એવું ન થાય એની વિશેષ કાળજ રાખીને વર્તણુકમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે મંડયા રહેશો તો જરૂર સફળતા મળશે જ.

ભણશાળી દ્રસ્ટ ભારા છેલ્લાં દશથી પણ વધુ વર્ષોથી બનાસકાંઠામાં

ચાલતા અફીણ-મુક્તિ કાર્યક્રમ હેઠળ

અચ્યાર સુધીમાં દશ હજારથી વધુ બંધાણીઓને સફળતાપૂર્વક અફીણ  
છોડાવી શકાયું છે.

## વ्यसनमुक्ति (DEADDICTION)

© લેખક: ડૉ. કેતન જહેરી, એમ.ડી. (by Dr.Ketan Jhaveri, MD)

Website: [www.jivanshaili.org](http://www.jivanshaili.org) અથવા

[www.geocities.com/jeevanshailee](http://www.geocities.com/jeevanshailee)

E-mail: [knj\\_ad1@sancharnet.in](mailto:knj_ad1@sancharnet.in) અથવા [jeevanshailee@yahoo.com](mailto:jeevanshailee@yahoo.com)

**પ્રકાશક: ભાણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક,**

૧/૫૪૧, સીદીક મહોલ્લો, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત

(ફોન: ૨૪૭૩૬૮૩ / ૨૪૬૦૮૨૭)

**બીજુ આવૃત્તિ: મે ૨૦૦૨; પૂનર્મુદ્રણ - જાન્યુઆરી ૨૦૦૫ (કુલ પ્રત ૫૦૦૦)**

(પ્રથમ આવૃત્તિ માર્ચ ૨૦૦૧, પ્રત ૨૦૦૦)

**મુદ્રક : ઉન્નતિ ઓફસેટ, નાનપુરા, સુરત.**

**કિંમત : દસ (૧૦/-) રૂપિયા.**

ISBN 81-88351-00-8

---

-----

**અગત્યાની નોંધ:** આ પુસ્તિકામાં આપવામાં આવેલ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટેની છે. આ માહિતીનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર દર્દીએ જાતે જ રોગના નિદાન કે સારવાર માટે કરવો નહીં. તબીબી જાણકારી રોજે રોજ બદલાતી રહે છે અને અહીં લખેલ માહિતિ જુની, અધુરી કે ભૂલવાળી હોઇ શકે છે. એટલાં માટે, કોઈપણ સારવાર કે જીવનશૈલીનાં ફેરફાર કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. દરેક દર્દીનું બંધારણ અલગ અલગ હોય છે એટલે તમને કદ્ય સારવાર માફક આવશે તે તમારા ડોક્ટર જ નકકી કરી શકે. આ પુસ્તિકાનો હેતુ માત્ર માહિતિ પુરી પાડીને જગૃતિ લાવવાનો જ છે.

## જીવન શૈલી કિલનિક ખાતે ઉપલબ્ધ પ્રકાશનો

જીવન શૈલી કિલનિક, ૧/૫૪૭, સિદ્ધીક મહોલ્લો, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત.

૩૮૫૦૦૭.(ફોન: ૦૨૬૧ - ૨૪૭૩૬૮૩ / ૨૪૬૦૮૨૭)

### સ્વસ્થ જીવનશૈલી સંપૂર્ણ

(ટપાલ ખર્ચ ૫/- પ્રતિ પુસ્તક)

૧. હાઇબલડપ્રેશાર (૬૦ પેજ. પાંચમી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૨. ડાયાબિટીસ (૬૪ પેજ. પાંચમી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૩. સ્વસ્થ આહાર (૮૮ પેજ. ચોથી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૪. મેદવૃદ્ધિ (જડાપણું) (૬૪ પેજ. ચોથી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૫. વ્યસનમુક્તિ (૬૦ પેજ. બીજી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૬. મનઃશાંતિ (૮૦ પેજ. બીજી આવૃત્તિ)	કિંમત રૂ.૧૦/-
૭. હૃદયરોગ (૧૦૪ પેજ. બીજી આવૃત્તિ)	કિંમત રૂ.૨૦/-
૮. હાઇબલડપ્રેશાર (૬૦ પેજ, પ્રથમ સંસ્કરણ)	કિમત રૂ ૧૦/-
૯. ડાયાબિટીસ (૬૦ પેજ, પ્રથમ સંસ્કરણ)	કિમત રૂ ૧૦/-
૧૦. હૃદયરોગ (૯૬ પેજ, પ્રથમ સંસ્કરણ)	કીમત રૂ ૨૦/-

### ----- ડૉ. કેતન અપેરી લિખિત અન્ય પ્રકાશનો-----

ઇમ્યુનીટી: એલજુથી એઈડ્સ સુધી	કિંમત રૂ.૫૦/-
તાવ આવે ત્યારે શું કરશો?	કિંમત રૂ.૨૫/-
ગ્રામ આરોગ્ય (માત્ર આરોગ્ય કાર્યકર માટે)	કિંમત રૂ.૩૦/-
પ્રાથમિક સારવાર (સહલેખક - ડૉ. કેતન ભરડવા)	કિંમત રૂ.૨૦/-
કોલેરસ્ટેરોલ વધવાની સમસ્યા (પરિચય પુસ્તિકા)	કિંમત રૂ. ૬/-
આરોગ્ય બિસ્સાપોથીઓ (કુલ પંદર બિસ્સાપોથી)	દરેકના રૂ. ૨/-
પ્લેગ	વિના મૂલ્ય

### જીવનશૈલી કિલનિક પ્રકાશિત પુસ્તકોના સુરત બહારના પ્રાપ્તિસ્થાન

મુંબઇ: આર.આર.શેઠ એન્ડ કુ., પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ ( ૦૨૨ - ૨૦૧૩૪૪૧ ).

અમદાવાદ: તાન્યા બુક વર્ક, મહારાજ પ્લેસ સામે, ચુનિવર્સિટી રોડ ( ૦૭૯ -૨૪૬૧૩૮૮૪ )

વડોદરા: જતન વિતરણ કેન્દ્ર, વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા.(૦૨૬૫-૨૩૭૧૪૮૦)

ડીસા: ગાંધી-લિંકન હોસ્પિટલ, બગીચા પાસે, ડીસા (૦૨૭૪૪-૨૨૦૮૪૪ /૨૨૦૧૭૨)

ભાવનગર: લોકમિલાપ ટ્રસ્ટ, સરદારનગર, ભાવનગર. ( ૦૨૭૮- ૨૫૬૫૫૬૬/૨૫૬૬૪૦૨ )

રાધનપુર: ભણશાળી ટ્રસ્ટ, રાધનપુર ( ૦૨૭૪૬ - ૨૪૭૩૪૩ / ૨૭૭૨૪૮ )